

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૨૧ માર્ચ ૨૦૨૪, ગુરુવાર
વિક્રમ સંવત ૨૦૮૦, ફાગણ સુદ બારસ

વર્ષ : ૧૫
અંક : ૨૩૦

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

ન્યૂઝ ડિસ્ક

પશ્ચિમ પાકિસ્તાનમાં પ.પની તીવ્રતાનો ભૂકંપ

। (એજન્સી) પાકિસ્તાન, તા.૨૦।
પશ્ચિમ પાકિસ્તાનમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પાકિસ્તાનમાં બપોરે ૨:૫૭ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જો કે હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ પહેલા ૧૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક રિક્ટર સ્કેલ પર ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગ (PMD) અનુસાર જાન્યુઆરીમાં પણ, પાકિસ્તાનના ભાગોમાં ૬.૦ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.તમને જણાવી દઈએ કે ૧૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક ભૂકંપ આવ્યો હતો.

૧૦૨ બેઠકો પર ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦।
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ તબક્કામાં જે રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે તે રાજ્યો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે ૧૮ એપ્રિલ, બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલ, ત્રીજા તબક્કા માટે ૭ મે, ચોથા તબક્કા માટે ૧૩ મે, પાંચમા તબક્કા માટે ૨૦ મે, છઠ્ઠા તબક્કા માટે ૨૫ મે અને સાતમા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે. પરિણામ ૪ જૂને આવશે. ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, મુક્ત અને સુરક્ષિત લોકસભા ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રથમ તબક્કા માટે ૨૭ માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે. ૨૮મી માર્ચે ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવારો પાછી બેંચવાની છેલ્લી તારીખ ૩૦મી માર્ચ છે.

નેશનલ પેન્શન સિસ્ટમની લોગીન પ્રક્રિયામાં ફેરફાર થશે | નવા નિયમો આગામી તા.૧ એપ્રિલ ૨૦૨૪થી લાગુ કરવામાં આવશે એનપીએસના ખાતાધારકો માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦।
જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ના ખાતાધારક છો, તો આ સમાચાર તમારા માટે છે. પેન્શન ફંડ નિયામક (પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની હાલની લોગિન પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમો આગામી તા. ૧ એપ્રિલ ૨૦૨૪ એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપ



મેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) એ માહિતી આપી હતી કે તે તેમની સિક્યુરિટી ફીચર્સને વધારવા જઈ રહી છે. હવે

એનપીએસએકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (સીઆરએસ) સિસ્ટમમાં લોગિન કરવા માટે ટુ-ફેક્ટર પ્રમાણીકરણ પ્રોસેસ પછી લોગિન કરી શકાશે. પેન્શન ફંડ નિયામકે આ અંગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. પીએફઆરડીએએ આ અંગે એક સર્ક્યુલર જાહેર કરી માહિતી આપી હતી કે, હવે સીઆરએસસિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિક્યુરિટી જોડવામાં

આવી છે. આ નવો નિયમ આગામી ૧ એપ્રિલ ૨૦૨૪થી લાગુ થશે. ત્યાર પછી એનપીએસખાતાધારકોને યુઝર આઈડી અને પાસવર્ડની સાથે- સાથે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપીમોકલવામાં આવશે. તેથી હવે પછી આ ઓટીપીદાખલ કર્યા બાદ જ યુઝર્સ તેમની સીઆરએસસિસ્ટમમાં લોગિન કરી શકશે. પીએફઆરડીએએ તેના જાહેર કરેલા સર્ક્યુલરમાં કહ્યું છે કે, આધાર આધારિત લોગિન ઓથેન્ટિકેશનથી સીઆરએમાં

લોગિન કરવું વધારે સુરક્ષિતરહેશે. વર્તમાન સમયમાં એનપીએસખાતા ધારકોને સીઆરએસસિસ્ટમમાં લોગિન કરવા માટે માત્ર એનપીએસનું આઈડી અને પાસવર્ડની જરૂર પડતી હતી. જેમા હવે નવું આધાર બેઝ વેરિફિકેશન સિક્યુરિટી ફીચરને એડ કરવામાં આવ્યું છે. તેથી હવે યુઝર્સને આઈડી પાસવર્ડ તેમજ આધાર બેઝ ઓથેન્ટિકેશન એટલે કે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપીઆવશે, તેને દાખલ કરવું પડશે.

મફતની યોજનાઓ જાહેર કરનારા પર લગામની માગ મફતની રેવડી સામેની પીઆઈએલ પર સુનાવણી માટે સુપ્રીમ તૈયાર

અરજીમાં મફતની રેવડી સંબંધિત નિર્ણયોને બંધારણની કલમ ૧૪, ૧૬૨, ૨૬૬ (૩) અને ૨૮૨નું ઉલ્લંઘન ગણાવાયા

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦।
સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે એક પીઆઈએલ વિસ્ટેડ કરવા પર સહમતિ આપી દીધી છે. આ પીઆઈએલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મફતની રેવડી એટલે કે મફત ભેટ કે યોજનાઓનો લાભ આપવાનો વાયદો કરવાની પ્રથા વિરુદ્ધ દાખલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ૧૮ એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૂ થવાની છે.



ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની

બેન્ચે બુધવારે કહ્યું કે આ જરૂરી છે અને અમે આ મામલે કાલે સુનાવણી ચાલુ રાખીશું. પીઆઈએલ દાખલ કરનાર અધિની ઉપાધ્યાય વતી હાજર વરિષ્ઠ વકીલ વિજય હંસારીયાએ દલીલ કરી કે અરજી પર લોકસભા ચૂંટણી પહેલા સુનાવણી જરૂરી છે. તેના પર ટોચની કોર્ટે તૈયારી બતાવી હતી. અરજીમાં રાજકીય પક્ષોના મફતની રેવડી સંબંધિત નિર્ણયોને બંધારણની કલમ ૧૪, ૧૬૨, ૨૬૬ (૩) અને ૨૮૨ નું ઉલ્લંઘન ગણાવાયા છે. અરજીમાં ચૂંટણી પંચને આવા રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન જમ કરવા અને રજિસ્ટ્રેશન કરવાનો નિર્દેશ આપવાની માગ કરાઈ છે. અરજીમાં દાવો કરાયો છે કે રાજકીય પક્ષો ખોટા લાભ લેવા માટે બેંકામ રીતે કે પછી તર્કહીન વાયદાઓ કરે છે અને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે જે લાંચ અને અયોગ્ય પ્રભાવ સમાન બાબત છે.

ભાજપે યુપીમાં ૫૧ ઉમેદવારની જાહેરાત કરી પતું કપાય તો વરૂણ ગાંધી અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે એવા સંકેત એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન વરૂણ ગાંધીએ પીલીભીતને મળેલી ભેટો માટે મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦।
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૫૧ ઉમેદવારોની જાહેરાત કરી છે. સોમવારે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં યુપીની ૨૫ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી.



વરૂણ લોકસભા મતવિસ્તારોમાં ફેરફારની અટકળોએ જોર પકડ્યું હતું. બરેલીના સાંસદ સંતોષ ગંગવારની સતત દસમી વખત ઉમેદવારી કરવાના માર્ગમાં ઉંમર આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ હંમેશા માલિની અને અન્ય કેટલાક નેતાઓને ટિકિટ મળવાને ટાંકીને પોતાની તરફેણમાં મજબૂત લોબિંગમાં વ્યસ્ત છે. તેવામાં, બદાયુનના સાંસદ સંઘમિત્રા મોર્યએ તેમના પિતા સ્વામી પ્રસાદ મોર્યના ભાજપ વિરુદ્ધ સતત વિવાદાસ્પદ નિવેદનોને કારણે સંકટ સર્જ્યું હતું. જોકે, સ્વામી પ્રસાદે સમાજવાદી પાર્ટીથી અલગ થઈને રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી બનાવી છે. જેને લઈને સંઘમિત્રા સતત બીજી વખત ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં પીલીભીતથી છેલ્લી ચૂંટણીમાં ભાજપના વરૂણ ગાંધીએ જીત મેળવી હતી.

નોઈડા તંત્રના કર્મચારીઓએ મહિલા -વૃદ્ધને કાર સાથે ટો કરી લીધા

। (એજન્સી) નોઈડા, તા.૨૦।
નો પાર્કિંગ વિસ્તારમાં ગાડી ઊભી કરવાથી પોલીસ વાહન ચાકને ઠંડ ફટકારે છે કે પછી ટ્રાફિક વિભાગ ગાડીને ટો કરીને લઈ જાય છે. જોકે આનું ત્યારે થાય છે જ્યારે ગાડી નો પાર્કિંગમાં ઊભી હોય અને તેમાં કોઈ હાજર ના હોય. નોઈડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કાર સહિત તેમાં બેસેલા લોકોને પણ કર્મચારીઓ ટો કરીને લઈ ગયા હતા. માહિતી અનુસાર વીડિયો નોઈડા સેક્ટર ૫૦ બજારનો છે.

ભારતીય શિક્ષકોએ દેશ છોડતા માલદીવમાં શિક્ષકોની અછત

। (એજન્સી) માલે, તા.૨૦।
ચીનના રવાડે ચઢીને ભારત વિરોધી વલણ અપનાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્ઞના કારણે માલદીવની જનતા હેરાન થઈ રહી છે. ભારત સામે સતત નફરત ફેલાવી રહેલી મોઈજ્ઞ સરકારના કારણે સંખ્યાબંધ ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધું છે અને તેના કારણે હવે ઘણી સ્કૂલો શિક્ષકોની અછતનો સામનો કરી રહી છે. આ મુદ્દો માલદીવની

સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે અને મોઈજ્ઞ સરકારને સ્પષ્ટતા કરવી પડી છે. માલદીવના મીડિયા રિપોર્ટ પ્રમાણે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ મોહમ્મદ શાહિદે સંસદમાં સરકારને સવાલ પૂછ્યો હતો કે, રાષ્ટ્રપતિ મોઈજ્ઞના ઈન્ડિયા આઉટ અભિયાનના કારણે ઘણા ભારતીય શિક્ષકો દેશ છોડીને જતા રહ્યા છે અને તેના કારણે દેશમાં શિક્ષકોની કમી ઉભી થઈ છે.

સંસદમાં બહુ મોટો સુધારો કરી દીધો છે. તેને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમની શૈક્ષણિક સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે, તેથી મુસ્લીમ સમાજ હવે દેશની મુખ્ય ધારા સાથે જોડાઈ ગયો છે, તેઓને ડર નથી રહ્યો, ગુંડારાજથી મુક્ત મળી છે. હવે કોંગ્રેસ, સપા, બસવા, આપ, રાજદ કે તુણમૂલ જેવા પક્ષોનો પદાંકાશ થઈ ગયો છે. તેઓએ વધુમાં કહ્યું કે મુસ્લીમ સમાજને જે પ્રકારના નેતાની જરૂર હતી, તેવા નેતા તેને નરેન્દ્ર મોદી તરીકે મળી ગયા છે. તેઓએ મહિલાઓને ત્રણ તલ્લાકમાંથી મુક્તિ આપી છે. મુસ્લીમ સમાજે

વિશ્વ આરોગ્ય સંસ્થાનો નવો અહેવાલ આરોગ્ય ક્ષેત્રે ૬૭ ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ ૨૪ ટકા ઓછું મહેનતાણું

। (એજન્સી) ન્યૂયોર્ક, તા.૨૦।
વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરૂષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછું મળે છે. ફેધર શેયર ફોર હેલ્થ કેયર નામના અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાં પુરું રોકાણ કરી શકતી નથી. આવક ધરાવતી

મહિલાઓ ૮૦ ટકા જેટલો પગાર પોતાના પરિવાર માટે ખર્ચી નાખે છે જ્યારે પુરૂષો પોતાની આવકનો ૩૦ થી ૪૦ ટકા જેટલો જ હિસ્સો ખર્ચે છે. પરિવારોમાં મહિલાઓને નિર્ણય લેવા માટે જે મહત્વ મળવું જોઈએ તે મળતું નથી. આરોગ્ય ક્ષેત્રમાં પરિવારોની બાગડોર મહિલાઓ ધરાવે છે પરંતુ વિડરશીપની ભૂમિકામાં પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ચિકિત્સા નિષ્ણતાંમાં પુરૂષોનો દબદબો છે.

મુસ્લિમ બહુમતી ધરાવતી ૧૦૦થી વધુ બેઠકો માટે ભાજપનો માસ્ટર પ્લાન વડાપ્રધાન મોદીએ પોતાનાં ૧૦ વર્ષના કાર્યકાળમાં મુસ્લીમ સમાજની સ્થિતિમાં બહુ મોટો સુધારો કર્યો

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦।
ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટી જનાધાર વધારવા માગે છે. તેના ભાગરૂપે તે લઘુમતિ સમાજને સાથે લેવા પ્રયત્નશીલ છે. ભાજપ લઘુમતિ મોર્યાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ૧૦ વર્ષના કાર્યકાળમાં મુસ્લીમ સમાજની

સ્થિતિમાં બહુ મોટો સુધારો કરી દીધો છે. તેને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમની શૈક્ષણિક સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે, તેથી મુસ્લીમ સમાજ હવે દેશની મુખ્ય ધારા સાથે જોડાઈ ગયો છે, તેઓને ડર નથી રહ્યો, ગુંડારાજથી મુક્ત મળી છે. હવે કોંગ્રેસ, સપા, બસવા, આપ, રાજદ કે તુણમૂલ જેવા પક્ષોનો પદાંકાશ થઈ ગયો છે. તેઓએ વધુમાં કહ્યું કે મુસ્લીમ સમાજને જે પ્રકારના નેતાની જરૂર હતી, તેવા નેતા તેને નરેન્દ્ર મોદી તરીકે મળી ગયા છે. તેઓએ મહિલાઓને ત્રણ તલ્લાકમાંથી મુક્તિ આપી છે. મુસ્લીમ સમાજે

ખાસ કરીને બહેનોએ હવે નારા શરૂ કર્યા છે ન દૂરી હે ન ખાઈ હે મોદી હમારા ભાઈ હે. ઉલ્લેખનીય છે કે ભાજપે લોકસભાની એવી ૬૫ સીટો તારવી છે જ્યાં મુસ્લીમ મતદારો ૩૫ ટકાથી વધુ છે. તેમાં સૌથી વધુ ઉ.પ્ર.માં ૧૪ સીટો છે, પ.બંગાળમાં ૧૩ સીટો, કેરળ ૮, આસામ ૭, જ.કા.પ, બિહાર ૪, મ.પ્ર. ૩ અને દિલ્હી, ગોવા, હરિયાણા, મહારાષ્ટ્ર અને તેલંગાણાની ૨-૨ લોકસભાની સીટો તે લીસ્ટમાં છે. જ્યારે તમિલનાડુની ૧ સીટ છે કે જે ઉક્ત મુસ્લીમ બહુમતિવાળી ૬૫ સીટોમાં સામેલ છે.

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ,
જે કરે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT
◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ cnngujarat.com વેબસાઈટ ઉપર વિગ્રીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

પાટડી પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી



1 (એજન્સી) પાટડી, તા.૨૦ |

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં પાટડી-ખારાઘોડા રોડ પર અડચણ રૂપ વાહન ચાલકો સામે દંડનીય તથા આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી એક અઠવાડિયામાં પાટડી પોલીસે કલમ ૨૦૭ હેઠળ ૪,૨૮૩ હેઠળ ૪ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૪ વાહન ચાલકો પાસેથી ૪,૪૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી પાટડી પોલીસ મથકના તકાલિન મહિલા પીએસઆઈ એલ.બગડાને લોક દરબાર પાટડી નગરમાં થતી આડેપડ પાર્કિંગની સમસ્યાનો નિવેડો લાવવા રજૂઆત મળ્યા બાદ રોડ પર અડચણરૂપ વાહન પાર્ક કરનારના વાહનને લોક લગાવી દંડ વસૂલવાની કામગીરી આરંભી હતી તકાલિન પીએસઆઈ એલ.બી.બગડા બદલી થાય બાદ ફરી આડેપડ પાર્કિંગ થતાં હાલાકી ઉભી થઈ રહી હતી ત્યારે પાટડી પોલીસ મથકના પીએસઆઈ એમ.બી.વીરજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા અને ધાંગણા ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પાટડી-ખારાઘોડા રોડ પર એક અઠવાડિયામાં પાટડી પોલીસે કલમ ૨૦૭ હેઠળ ૪,૨૮૩ હેઠળ ૪ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૪ વાહન ચાલકો પાસેથી ૪,૪૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં પાટડી પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજભા વણોલ, ગૌતમ ગેડીયા સહિતના સ્ટાફ દ્વારા નિયમભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાટડી-ખારાઘોડા રોડ પર શાળા, કોલેજ, કોર્ટ, ખેતીવાડી બજાર આવેલ હોવાથી વાહનોની અવરજવર વધારે રહે છે રોડ ખાતાની હદમાં ગેરકાયદે શેડ બાનાવી દબાણ થવાના કારણે વાહનચાલકોને વાહન પાર્ક કરવાની જગ્યા ન મળતા રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે.



દરિયાપુર તીન ભત્તી પાસે આવેલ ખાદુરશ્યામ મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા ઘણા ચઢાવવામાં આવી હતી.

એક દાયકામાં સૌથી ઓછા શિપ આવ્યા મિડલ ઈસ્ટની ફટોકટી અને વધતા ફેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યો છે

અલંગ શિપ રિસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીમાં કુલ ૧૩૦ પ્લેટ છે જેમાંથી માત્ર ૩૦ પ્લોટ હાલમાં ઓપરેશનલ છે, છેલ્લા અઠી મહિનામાં લેબર માત્ર ૧૫ દિવસ કામ કરે છે

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ | ગુજરાતમાં અલંગ ખાતે વિશ્વમાં સૌથી મોટો શિપ રિસાઈકલિંગનો ઉદ્યોગ ચાલે છે જેને તાજેતરમાં મિડલ ઈસ્ટની ફટોકટી અને વધતા ફેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાતા સમુદ્રમાં જોખમી સ્થિતિ હોવાના કારણે રિસાઈકલિંગ માટે અલંગ આવતા શિપની સંખ્યા એક દાયકાના તળિયે પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૧૬માં અલંગ ખાતે ૩૧૩ શિપ રિસાઈકલિંગ માટે આવ્યા હતા જેની સંખ્યા ૨૦૧૭માં ૨૩૦ અને ૨૦૧૮માં ૨૫૮ હતી. ત્યાર પછી ૨૦૧૯માં માત્ર ૧૯૦ શિપ,

૨૦૨૦માં ૧૯૯ શિપ, ૨૦૨૧માં ૨૦૫ આવ્યા હતા. ત્યાર પછી તે આંકડો ૧૫૦ શિપથી પણ નીચે જતો રહ્યો છે. ૨૦૨૨માં અલંગ ખાતે ૧૪૧ શિપ આવ્યા હતા જ્યારે વર્ષ ૨૦૨૩માં સૌથી નબળો દેખાવ હતો અને માત્ર ૧૩૬ શિપ રિસાઈકલિંગ માટે આવ્યા હતા. ભાવનગર પાસે અલંગમાં સ્થિતિ એવી છે કે શિપ રિસાઈકલિંગ ઉદ્યોગ ગમે ત્યારે ખતમ થઈ જાય તેમ છે. અલંગ શિપ રિસાઈકલિંગ એસોસિએશનના સેક્રેટરી હરેશ પરમાર કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં સુધારાના કોઈ સંકેત જોવા મળતા નથી. તેમણે કહ્યું કે અલંગ શિપ રિસાઈકલિંગ

ઈન્ડસ્ટ્રીમાં કુલ ૧૩૦ પ્લેટ છે જેમાંથી માત્ર ૩૦ પ્લોટ હાલમાં ઓપરેશનલ છે. છેલ્લા અઠી મહિનામાં લેબર માત્ર ૧૫ દિવસ કામ કરે છે. ૨૦૨૩માં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછા શિપ અલંગ આવ્યા હતા. અલંગમાં આટલી ઓછી સંખ્યામાં શિપ આવ્યા તેના ઘણા કારણો છે. એક તો, કોવિડ પછી ફેઈટ રેટ વધી ગયા છે. તેના કારણે કંપનીઓ શિપને રિસાઈકલિંગ માટે મોકલતી નથી અથવા શક્ય હોય ત્યાં સુધી મોડું કરે છે. રાતા સમુદ્રમાં કટોકટીના કારણે ફેઈટ રેટમાં મોટો વધારો થયો છે.

ગત વર્ષની સરખામણી ભાવમાં ખાસ તફાવત નથી વર્ષભરનાં ઘઉં ખરીદવાની સીઝન શરૂ, હોલસેલ માર્કેટમાં ભીડ જામી

1 (એજન્સી) પોરબંદર, તા.૨૦ |

ઉનાળા સીઝન ગુલિહીઓ માટે મહત્વની હોય છે. વર્ષભરની વસ્તુઓનો તૈયાર કરવાની હોય છે. ઉનાળામાં ધાણા, જીરું, હળદર, મરચું, અથાણા, અનાજ વગેરેની તૈયારી કરવામાં આવે છે. બજારમાં આ તમામ વસ્તુઓનો સ્ટોક પણ લાગી ગયા છે. ખાસ કરીને ઉનાળામાં વર્ષભરની ખરીદી કરવામાં આવે છે. પોરબંદરમાં હોલસેલ ભાવમાં ઘઉંનું મળી રહ્યું છે. લોકો ઘઉંની ખરીદી કરી રહ્યાં છે. બજારમાં ઘઉંના ભાવ ૫૫૦ રૂપિયાથી લઈને ૭૫૦ રૂપિયા છે. ઘઉંના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી. પોરબંદરમાં છેલ્લા ૪૦ વર્ષથી કુશાલભાઈ મોનાણી અનાજનો હોલસેલનો વેપાર કરી રહ્યાં છે. કુશાલભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૪૦થી અનાજનો વેપાર સાથે જોડાયેલા છીએ. પહેલા અનાજ ખરીદી કરવામાં આવે છે. બાદ ગ્રેડિંગ



કરી અનાજની સફાઈ કરવામાં આવે છે. બાદ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ઉનાળોનો પ્રારંભ થતા લોકો ખરીદી કરી રહ્યાં છે. બજારમાં લોકવન અને ટુકડા ઘઉંનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાની પસંદ મુજબનાં ઘઉં ખરીદી રહ્યાં છે. ભાવની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ ભાવમાં ખાસ વધારો થયો નથી. હાલ ઘઉંના ભાવ ૫૫૦ રૂપિયાથી લઈને ૭૫૦ રૂપિયા છે. લોકો ઘઉંની સાથે ધાણા, જીરું વગેરેની પણ ખરીદી કરી રહ્યાં છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ અસાયલમ ઓફિસરની સંખ્યા વધારી અમેરિકામાં હવે ઈલીગલિ આપેલા લોકોને અસાયલમ સરળતાથી નથી મળવાની!



1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ |

ડોનાલ્ડ ટ્રમ્પ હાલ એવા દાવા કરી રહ્યા છે કે પોતે જો ફરી પ્રેસિડેન્ટ બનશે તો લાખો અન-ડોક્યુમેન્ટેડ ઈમિગ્રેન્ટ્સને ડિપોર્ટ કરી દેશે. જોકે, હોમલેન્ડ સિક્યોરિટીના આંકડાને ટાંકીને વોશિંગ્ટન પોસ્ટ નામના અમેરિકન અખબારે જે દાવો કર્યો છે તે દર્શાવે છે કે અમેરિકાએ મે ૨૦૨૩થી જ ડિપોર્ટશનની સંખ્યા ડબલ કરી દીધી છે, અને બોર્ડર કોસ કરીને ઈલીગલિ આવેલા લોકોના અસાયલમ એટલે કે શરણાગતિ માગવાના દાવા પણ મોટી સંખ્યામાં રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટનો દાવો છે કે એક વર્ષ પહેલા જેટલા લોકોના કેડિબલ ફિયર ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તેની સંખ્યા પણ હવે બમણી થઈ ગઈ છે. અમેરિકાની સેનેટમાં ગયા મહિને એક બિલ લાવવામાં આવ્યું હતું, જેનો હેતુ ઈમિગ્રેશન ડિટેન્શન કેમ્પોલિટી વધારવા ઉપરાંત ડિપોર્ટશનની પ્રોસેસને ઝડપી બનાવવા માટે ૪૩૦૦ અસાયલમ ઓફિસર ડાયર કરવાનો હતો. જોકે, તેના માટે ૬ બિલિયન ડોલરની ફંડને મંજૂર કરવા લાવવામાં આવેલું આ બિલ પાસ નહોતું થઈ શક્યું. જો આ બિલ પાસ થઈ ગયું હોત તો અમેરિકામાં ઈલીગલિ એન્ટર થયેલા લોકોને લાંબો સમય જેલમાં રાખવા ઉપરાંત તેમને ડિપોર્ટ કરવાની કામગીરી ઝડપી બનાવી શકાઈ હોત. ડિપાર્ટમેન્ટ ઓફ

હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા મે ૨૦૨૩થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૪ના ગાળામાં ૧.૧૫ લાખ માર્ગચૂંટના કેડિબલ ફિયર ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ૧,૦૦૦ જેટલા અસાયલમ ઓફિસરને આ કામમાં લગાડ્યા છે, અને આવનારા સમયમાં તેને વધુ ઝડપી બનાવવા વધુ ઓફિસરને ટ્રેનિંગ અપાઈ રહી છે. જોકે, હકીકત એ પણ છે કે જે ગાળામાં બોર્ડર કોસ કરીને આવેલા ૧.૧૫ લાખ માર્ગચૂંટના કેડિબલ ફિયર ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તે જ ગાળામાં બોર્ડર કોસ કરનારા લોકોની સંખ્યા ૧૭ લાખ નોંધાઈ હતી, મતલબ કે બોર્ડર કોસ કરીને આવનારા ૧૦ ટકાથી પણ ઓછા લોકોના કેડિબલ ફિયર ઈન્ટરવ્યુ થઈ શક્યા હતા. હાલ સ્થિતિ એ છે કે અમેરિકા પાસે બોર્ડર કોસ કરીને આવેલા લોકોને ડિટેન્શનમાં રાખવાની જગ્યા ના હોવાથી માર્ગચૂંટને કોર્ટમાં હાજર થવાની તારીખ આપીને રિલીઝ કરવામાં આવી રહ્યા છે. જે રીતે આખીય સિસ્ટમ અપગ્રેડ કરાઈ રહી છે તેને જોતા એવું ચોક્કસ કહી શકાય કે ટ્રમ્પ ફરી અમેરિકાના પ્રેસિડેન્ટ બને કે ના બને, પરંતુ હવે અસાયલમ માટે ખોટા દાવાઓ કરતા અન-ડોક્યુમેન્ટેડ ઈમિગ્રેન્ટ્સ પર સંકેતે કસવાની અમેરિકા પૂરી તૈયારી કરી રહ્યું છે.



લોકસભાનું ઇલેક્શન જાહેર થવાથી પોલિટીકલ પાર્ટીના ભોંડ પર કુચડા મારવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં બીજી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

1 (એજન્સી) સુરત, તા.૨૦ |

સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મુતકના પરિવારે કરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે આજ રોજ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી

નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મુતક દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલના મુતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર

હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજરોજ પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલના મુતદેહનો કબ્જો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જે દરમિયાન સુરત પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ પરિવારજનો મુતદેહને લઈ અંતિમ વિધિ માટે નિવાસસ્થાન ખાતે લઈ ગયા હતા. જોકે આ દરમિયાન મુતકના પરિવારજનોએ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે.

પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્યની પસંદગી કોંગ્રેસ દ્વારા પણ ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર થતાં ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારની ટક્કર જોવા મળશે

1 (એજન્સી) પંચમહાલ, તા.૨૦ |

લોકસભાની ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે, ત્યારે તમામ પક્ષો બાકીની બેઠકો પર તેમના ઉમેદવારો પસંદ કરી રહ્યા છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્યને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફોન દ્વારા જાણ કરી ઉમેદવારી કરવા સૂચન કરવામાં આવ્યું છે. પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં

આવ્યો છે. ગુલાબસિંહ ચૌહાણને ફોન દ્વારા જાણ કરી ઉમેદવારી કરવા સૂચન કરવામાં આવ્યું છે. પંચમહાલ લોકસભા સીટ પર ભાજપ દ્વારા રાજાલાલસિંહ જાદવને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર થતાં ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારની ટક્કર જોવા મળશે. ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના માજી વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લુણાવાડાના વિરણીયાના રહેવાસી છે. તેમણે બી.કોમ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો, ૨૦૦૬થી ૨૦૧૦

સુધી વિરણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય તરીકે બે ટર્મ રહ્યા છે. તો મહીસાગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી છે. ગુલાબસિંહ ચૌહાણ આ ઉપરાંત પણ વિવિધ પદો પર રહી ચૂક્યા છે, જેમકે મહીસાગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, ધી વિરણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, ધી અર્થશ્રમ સેવા સહકારી મંડળી વિરણીયાના ચેરમેન, ધી પિયત મંડળી વિરણીયાના ચેરમેન, સહભાગી વન વ્યવસ્થા મંડળી વિરણીયાના પ્રમુખ, જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ, લુણાવાડા તાલુકા બક્ષિપંચ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.

સાબરઝેરીના સત્તાધીશો સામે ખુદ ડિરેક્ટરે જ આક્ષેપો કર્યા

1 (એજન્સી) ત્રાંતિજ, તા.૨૦ |

સાબરઝેરીના સત્તાધીશો સામે ખુદ ડિરેક્ટરે જ આક્ષેપો કર્યા છે. સાબરઝેરીની મુખ્ય ઓફિસના પગથિયાંમાં બેસી જઈને ડિરેક્ટરે વિરોધ દર્શાવીને આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાબરઝેરીના ડિરેક્ટર જશુ પટેલે મંગળવારે સાંજે વિરોધ પ્રદર્શન કરીને સાબરઝેરી સામે આક્ષેપો કર્યા હતા. સાબરઝેરીની સામાન્ય ચૂંટણી હાલમાં જ સમાપ્ત થઈ છે. જેમાં ૧૬ માથી ૧૫ ડિરેક્ટર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે માલપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાબરઝેરીની પૂર્વ ડિરેક્ટર ફરી એકવાર ચૂંટાઈ આવ્યા હતા. વિજયી થયાના દશ દિવસનો પણ સમય પૂર્ણ થયો નથી ત્યાં ડિરેક્ટરે સાબરઝેરીના સત્તાધીશો સામે સવાલો કરી દીધા હતા. જશુ પટેલે ડેરીની ઓફિસના પગથિયાંમાં બેસી જઈને વિરોધ કર્યો હતો.

ઘાટલોડીયાના ડોક્ટર સાથે મહેસાણાના બિલ્ડરે ૬.૨૫ કરોડની ઠગાઈ કરી

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ |

ઘાટલોડીયાના ડોક્ટરને બિલ્ડરે ગુરુકુલમાં સ્કિમ મુકવાનું કહી તેમાં પૈસાની જરૂર છે તમને સારો નફો આપીશું તેવી વાત કરી ૬.૨૫ કરોડ રૂપિયા લીધા હતા અને બાદમાં ૪૮ લાખ પરત આપ્યા હતા. બાકીના એક પણ રૂપિયો આપવાની ના પાડી દઈ પૈસા માંગ્યા તો ખોટા કેસમાં ફસાવી દેવાની મહેસાણાના બિલ્ડરે ધમકી આપી હતી. આ અંગે કોર્ટમાં બ્રાંચે મહેસાણાના બિલ્ડર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના થલેજ વિસ્તારમાં આવેલા નારાયણ કુટીર બંગલોમાં નરેશભાઈ મલ્હોત્રા (ઉ.પ.૦) પરિવાર સાથે રહે છે. ઘાટલોડીયા ખાતે આદિત્ય મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ નામથી છેલ્લા ૨૨ વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે. વર્ષ ૨૦૧૮માં નારાયણ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીના ભાગીદાર વતી રઘુ શંકરભાઈ પટેલ (રહે. પટેલ વાસ, મણીપુર ગામ, મહેસાણા) સાથે ગુરુકુલ ખાતે અરીહંતનગર નામની ફ્લેટની સ્કિમમાં રીડેવલોપીંગ ચાલુ કર્યું હતું. આ જગ્યા પર નારાયણ એકઝેટીકા નામની રેસિડન્સ અને કોમર્શીયલ સ્કિમ ચાલુ કરી હતી. તેના નાણાની જરૂર હોવાથી રઘુ પટેલે તેમની સ્કિમ અંગેની માહિતી મને આપી હતી. પાંચ વર્ષનું રોકાણ તેમા નફો આપવાની વાત કરી હતી. જેમાં ૨૦૨૩ની જરૂર હતી. ડો. નરેશભાઈએ ૧.૭૩ કરોડ અને બીજા આરટીએસ કરી હતી. બાદમાં ૪.૫૨ કરોડ જકશીભાઈ ભરવાડની હાજરીમાં હોસ્પિટલ પરથી અલગ અલગ સમયે તઈ ગયા હતા.

ન્યૂઝ ફિક્સ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું ૧૨૦૦ ડોલરની ખંડણી માટે અપહરણ



! (એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦ | અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક અફત આવી રહી છે. તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકાની કબીલવેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા ૨૫ વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અબ્દુલ હેદાબાદનો રહેવાસી છે અને તે સાત માર્ચથી લાપતા હોવાની જાણકારી તેના પરિવારને મળી છે. વધારે ચોકાવનારી વાત એ છે કે, અબ્દુલના પિતા મહોમ્મદ સલીમને ફોન કરીને અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે કે, અમે અબ્દુલને કિડનેપ કરી છે અને તેને સુરક્ષિત જોવો હોય તો ૧૨૦૦ ડોલર મોકલો. ફોન કરનારે પોતાની ઓળખ કબીલવેન્ડમાં ડુગ વેચનારી ગંગના સભ્ય તરીકે આપી છે. ફોન કરનારે તો એવું પણ કહ્યું હતું કે, જો તરત પૈસા નહીં મોકલવામાં આવે તો અમે અબ્દુલની કિડની વેચી દઈશું. આ પ્રકારની ધમકી મળ્યા બાદ અમેરિકામાં રહેતા અબ્દુલના સબંધીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હવે અબ્દુલની શોધખોળ શરૂ કરી છે. અબ્દુલનો પરિવાર ૧૮ માર્ચે શિકાગોમાં ભારતીય કોન્સુલેટમાં પણ ગયો હતો અને અબ્દુલને શોધવા માટે મદ માંગી હતી. જોકે હજી સુધી અબ્દુલનો કોઈ પતો મળ્યો નથી.

વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમાંકે



! (એજન્સી) ન્યૂયોર્ક, તા. ૨૦ | ભારતમાં મીઠાઈઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઈઓમાં ભારતની રસ મલાઈ બીજા ક્રમે આવી છે. જ્યારે પોલેન્ડની સેનિક મીઠાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેનિકદહી, પનીર, ડુંડા અને પાંડામાંથી તૈયાર કરવામાં આવે છે. ગ્રીસની મલાઈદાર સ્થાનિક મીઠાઈ સફાકિયોનોપિટાને ત્રીજું સ્થાન મળ્યું હતું. આ મીઠાઈને શહદ અને દાલચીની સાથે પીરસવામાં આવે છે. ટેસ્ટ એટલસના સર્વશ્રેષ્ઠ મિઠાઈ ચિટ્ટમાં સ્વાદિષ્ટ વ્યંજન રસમલાઈના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. સ્વાદિષ્ટ વ્યંજન રસમલાઈ કેસરચુકત દુધની ચાસણીમાં ભેળવીને પીરસવામાં આવે છે. આ મીઠાઈમાં સફેદ કીમ, ચીની, દૂધ એક પ્રકારના પનીર અને ઈલાયચીનો હળવો સ્વાદ હોય છે. રસ મલાઈને કેસર, કાજુ અને બદામથી સજાવવામાં આવે છે.

દાઉદ ઈબ્રાહિમે મુસ્લિમો માટે ઘણું કર્યું છે: મિયાંદાદ



! (એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૨૦ | પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના સંબંધો કોઈથી છૂપા નથી. બંને એકબીજાના વેવાઈ છે. હવે વરને કોણ વખાણે તો કહે વરની મા એ નાતે જાવેદ મિયાંદાદે ડોન દાઉદ ઈબ્રાહીમના ભરી ભરીને વખાણ કર્યા છે. મુંબઈમાં ૧૯૮૩માં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ ફરી એકવાર ચર્ચામાં છે. જેને ચર્ચામાં લાવનાર છે પાકિસ્તાનનો એક પૂર્વ ક્રિકેટર. તેણે તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમના ખૂબ વખાણ કર્યા હતા. એક પાકિસ્તાની પત્રકારની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ક્રિકેટર જાવેદ મિયાંદાદે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વખાણ કરતા કહ્યું હતું.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટ-અપ મહાકુંભ પ્રદર્શનની મુલાકાત કરી હતી.

કેન્દ્રીય પ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન શોભા કરંદલાજેના નિવેદનની સ્ટાલિન દ્વારા ટીકા

શોભા કરંદલાજે બેંગલુરુના રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસના આરોપી અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો

! (એજન્સી) બેંગલુરુ, તા. ૨૦ | બેંગલુરુના રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસના આરોપી અંગે કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, હવે તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો તાલીમ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં માર્ચ ૧ ના રોજ બેંગલુરુના રામેશ્વર કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરીને શોભા કરંદલાજે એવું કહી રહ્યા છે કે, 'તમિલનાડુના લોકો અહીં આવે



છે, ત્યાં તાલીમ મેળવે છે અને અહીં બોમ્બ પ્લાન્ટ કરે છે. તેમાંથી કોઈએ રહેવાસી છે. તેમણે એવો દાવો કર્યો હતો કે બોમ્બ વિસ્ફોટના આરોપીઓને તમિલનાડુના કૃષ્ણાગિરી જંગલોમાં તાલીમ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં માર્ચ ૧ ના રોજ બેંગલુરુના રામેશ્વર કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ કરીને શોભા કરંદલાજે એવું કહી રહ્યા છે કે, 'તમિલનાડુના લોકો અહીં આવે

તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, 'હું મારા તમિલ ભાઈઓ અને બહેનોને સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા શબ્દોનો અર્થ કોઈને હાની પહોંચાડવાનો નથી. આમ છતાં મારી ટિપ્પણીઓથી કેટલાક લોકોને દુઃખ થયું છે. હું આ માટે માફી માંગુ છું. મારી ટિપ્પણીઓ માત્ર બ્લાસ્ટની ઘટના સાથે સંબંધિત હતી. હું મારું અગાઉનું નિવેદન પાછું ખેંચું છું.' શોભા કરંદલાજે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન પર હિન્દુઓ અને ભાજપના કાર્યકરોને નિશાન બનાવવા માટે કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહિત આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું, મિસ્ટર સ્ટાલિન, તમારા શાસન હેઠળ તમિલનાડુનું શું થઈ ગયું છે. તમારી તુષ્ટિકરણની રાજનીતિ

યુએન દ્વારા હેપ્પીનેસ ઈન્ડેક્સ જાહેર કરાયો

પુશ રહેવાની બાબતમાં ભારતીયો વિશ્વમાં ૧૨૬મા ક્રમ પર

! (એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦ | ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે ૨૦ માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય છે. આ દિવસે યુએન દ્વારા હેપ્પીનેસ ઈન્ડેક્સ જાહેર કરે છે. આ દિવસની ઉજવણી ૧૨ જુલાઈ, ૨૦૧૨માં શરૂ થઈ હતી. તેમજ ઉજવણીનો મુખ્ય હેતુ તમારા સારા સ્વાસ્થ્ય માટે પુશ રહેવું ખૂબ જ જરૂરી છે આ બાબત લોકોને સમજાવવાનો છે. જાણો કેવી રીતે આ દિવસની ઉજવણી અને કયો દેશ સૌથી પુશ છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર વાંગચુકે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટનો પ્રસ્તાવ યુએનમાં મુક્યો હતો. ત્યાંના રાજાનું માનવું હતું કે

લોકોની પુશી દેશની આર્થિક સ્થિતિ પર નિર્ભર નથી. ૧૯૭૦ના દાયકામાં, ભૂટાન વિશ્વનો પહેલો દેશ હતો જેણે જીડીપી કરતાં લોકોની સુખાકારીને વધુ મહત્વ આપ્યું હતું. આથી રાજાએ ૧૨ જુલાઈ ૨૦૧૨ના રોજ યુએનમાં હેપ્પીનેસ ડે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. કારણ કે આ જ દિવસે ભૂટાન વિદેશીઓ માટે પોતાની સરહદો ખોલી રહ્યું હતું. ભૂટાન હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ટોચના ૧૦ દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ છે અને તે અશિયાનો સૌથી પુશ દેશ માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટની ઉજવણી માટે ૨૦ માર્ચની પસંદગી કરવા પાછળ એક ખાસ કારણ ખેસર વાંગચુકે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટનો પ્રસ્તાવ યુએનમાં મુક્યો હતો. ત્યાંના રાજાનું માનવું હતું કે



અને રાત સરખા હોય છે. આ ઘટના વર્ષમાં બે વખત ઘટે ૨૦૦ એક ૨૦ માર્ચ અને બીજી ૨૩ સપ્ટેમ્બર. આ જ કારણે આજના દિવસે વર્લ્ડ હેપ્પીનેસ ડે ઉજવવામાં આવે છે. દેશ વધુ પુશ છે કે ઓછો તે માપવા માટે ડે મુખ્ય પરિભળો છે, જેમાં સામાજિક સમર્થન, આવક, આરોગ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને બ્રાહ્મચર્યની ગેરહાજરી જેવા માપદંડો

પરથી દેશના લોકો કેટલા પુશ છે તે નક્કી કરવામાં આવે છે. એન્યુઅલ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૪ અનુસાર, ભારતના લોકો પુશ રહેવામાં ઘણા પાછળ છે. દુનિયાના ૧૪૬ દેશોમાં પુશીની બાબતમાં ભારતનું રેકોર્ડ ૧૨૬મું છે. આ ઉપરાંત જો ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ પુશ રહે છે. જ્યારે અફઘાનિસ્તાનના લોકો પુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે. આ રિપોર્ટ એક અન્ય એવી વાત પણ સામે આવી છે કે પુશ દેશોની યાદીમાં કોઈ મોટો દેશ ટોપ પર નથી. ટોપ ૨૦માં મોટા દેશોમાં યુકે અને કેનેડાની વસ્તી ૩૦ મિલિયનથી વધુ છે જ્યારે નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વસ્તી ૧૫ મિલિયનથી વધુ છે. આ વિસ્તરમાં કિનલેન્ડે ફરી એકવાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા સંજોગો પાક. સેનામાં ફરજ બજાવતા બે અફઘાનોની હકાલપટ્ટી અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરાયા હોય એવા બે શખ્સોને બરતરફ કરાયાનો સંરક્ષણ મંત્રીનો દાવો

! (એજન્સી) ઈસ્લામાબાદ, તા. ૨૦ | પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા સંજોગો ઉભા થયા છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાની તાલિબાન સરકાર સામે આકરુ વલણ અપનાવી રહી છે. જેના ભાગરુપે પાકિસ્તાને પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને દેશની બહાર કાઢવાના અભિયાનને તેજ કરી દીધું છે. પાકિસ્તાનની આર્મીમાં અધિકારી તરીકે કામ કરી રહેલા બે અફઘાન નાગરિકોની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. તાજેતરમાંજ પાકિસ્તાની એરફોર્સિસ અફઘાનિસ્તાનની બોર્ડરમાં ઘુસીને હુમલા કર્યા હતા. જેમાં આઠ મહિલાઓના મોત થયા હતા. એ મળી બંને દેશો વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં આશ્રય લઈ રહેલા તહેરિક એ તાલિબાન



આતંકીઓ પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે અને તેના કારણે તેમની પર કાર્યવાહી કરવાની જરૂર છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ચોકાવનારો દાવો કરતા કહ્યું હતું કે, બોર્ડર ખુલ્લી હોવાથી અફઘાન ઘુસણખોરો દેશમાં ઘુસી જાય છે અને પોતે પાકિસ્તાનમાં રહેતા હોવાના દસ્તાવેજો પણ મેળવી શકે છે. ત્યાં સુધી કે તેઓ અફઘાનિસ્તાન વચ્ચે ઉભી થયેલી છે. સંરક્ષણ મંત્રી તરીકે મેં બે થી ત્રણ એવી ફાઈલ પર સહી કરી છે જેમાં

અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય. આ પૈકી એક કેપ્ટન અને એક લેફ્ટનન્ટ હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ગત ૩૧ ઓક્ટોબરથી દેશમાં ગેરકાયદે રહેતા અફઘાન નાગરિકોને પાકિસ્તાનમાંથી પાછા મોકલવાનું અભિયાન શરૂ કર્યું છે અને તેને લઈને સંરક્ષણ મંત્રીએ એક પાકિસ્તાની અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ઉપરોક્ત વાત કરી હતી. એક અંદાજ અનુસાર પાકિસ્તાનમાં ૧૭ લાખ અફઘાન નાગરિકો રહે છે અને તેમાંથી ૧૪ લાખને શરણાર્થી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. પાકિસ્તાને યોગ્ય દસ્તાવેજો વગર રહેતા લોકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે અને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે ઉભી થયેલી કડવાશનું એક મોટું કારણ ઉપરોક્ત નિર્ણય પણ છે.

શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા સેન્સેક્સમાં ૮૯ અને નિફ્ટીમાં ૨૨ પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો ટોપ ગેઈનર્સમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, નેસ્લે, ઓએનજીસી, એસબીઆઈ-બીપીસીએલના શેરનો સમાવેશ

! (એજન્સી) મુંબઈ, તા. ૨૦ | શેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ ૮૯ પોઈન્ટના ઊછાળા સાથે ૭૨૧૦૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૧૮૦૦ની સપાટી જાળવી રાખ્યો છે અને ૨૨ પોઈન્ટના ઊછાળા સાથે ૨૧૮૩૮ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે. શેરબજારના અસ્થિર રૂટિંગ સમયગાળા દરમિયાન, નિફ્ટી એફએમસીએ અને નિફ્ટી ઓટો સુચકાંકોમાં નજીવો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી મિડ કેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી બેક, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ હતી. શેરબજારમાં ટોપ ગેઈનર્સમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી,



પાવર ગ્રીડ, નેસ્લે, ઓએનજીસી, એસબીઆઈ અને બીપીસીએલના શેરનો સમાવેશ થાય છે, જ્યારે શેરમાં સારો એવો ઊછાળો જોવા મળ્યો છે. બુધવારે રિલાયન્સ પાવરના શેરમાં ૫ ટકાની અપર સર્કિટ લાગી હતી. બુધવારે સાંજે યુપીએલનો સમાવેશ થાય છે. સામેલ દિવસ દરમિયાન શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા છે. નિફ્ટી ૫૦ એ આ વર્ષે નકારાત્મક વળતર આપ્યું છે. સ્ક્રી દ્વારા રેટિંગ અપગ્રેડ થવાને કારણે આઈશર મોટર્સના શેરમાં સારો એવો ઊછાળો જોવા મળ્યો છે. બુધવારે રિલાયન્સ પાવરના શેરમાં ૫ ટકાની અપર સર્કિટ લાગી હતી. બુધવારે સાંજે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની બેઠક સાથે જોડાયેલી માહિતી આવવાની છે, જેના કારણે બજારમાં સાવધાનીભરી કારોબાર જોવા મળી રહી છે.

ડાન્સ કરતા લોકોથી કંટાળી કંબોડિયામાં મ્યુઝિકલ હોર્ન પર પ્રતિબંધ મુકાયો

! (એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦ | કંબોડિયાના વડાપ્રધાને એક ચોકાવનારો નિર્ણય લીધો છે. તેમણે વાહનોના મ્યુઝિકલ હોર્ન પર પ્રતિબંધ લગાવી દીધો છે. દક્ષિણ પૂર્વ એશિયામાં કંબોડિયા નામનો એક દેશ છે. તેમણે વાહનોના મ્યુઝિકલ હોર્ન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો. આ હોર્નના કારણે લોકો રસ્તાઓ પર ડાન્સ કરવા લાગી જતા હતા. હું માનેટે પરિવહન અને પોલીસ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે, કોઈપણ વાહનમાંથી મ્યુઝિકલ હોર્ન સંભળાઈ તે તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તેમણે જણાવ્યું કે, આ આદેશ પ્રાંતીય અધિકારીઓ દ્વારા પહેલાથી જ લાગુ કરવામાં આવી ચૂક્યો છે. પરંતુ તેઓ આની જાહેરાત સાવજનિક રીતે કરવા માગતા હતા જેથી તેને દેશભરમાં લાગુ



કરી શકાય. હું માનેટ ગત વર્ષે ૨૦૨૩માં કંબોડિયાના વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા ૩૮ વર્ષ સુધી તેમના પિતા હું સેન પીએમ પદ પર રહ્યા હતા. તેમણે સોમવારે પોતાના ફેસબુક પર લખ્યું કે, કેટલાક લોકો, ખાસ યુવાઓ અને બાળકોને રસ્તા કિનારે ટૂંકોના હોર્નની ધૂન પર ડાન્સ કરતા નજર આવ્યા. જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. કંબોડિયાના વડા પ્રધાને કહ્યું કે રસ્તા વચ્ચે ડાન્સ કરવાથી જાહેર વ્યવસ્થા પ્રભાવિત થાય છે અને ટ્રાફિક પર અસર પડે છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી જેમાં એક વીડિયોમાં ત્રણ યુવકો રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહ્યા છે.

ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર

! (એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦ | ક્લાઈમેટ ચેન્જ સાથે સંબંધિત એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થવાની છે. માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ પેટર્નમાં ફેરફાર થવાને લીધે તેની

આજુબાજુના વિસ્તારોમાં લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. હાઈવેટિંગ રિવર બેસિન ગવર્નન્સ એન્ડ કોઓપરેશન ઈન ધ એચકેએચ રિજન રિપોર્ટમાં ત્રણેય નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર પર નદીના બેસિન મેનેજમેન્ટ માટે ક્લાઈમેટ અંગે ફલેક્સિબલ દરિયાકોળી જરૂર છે.


તંત્રી લેખ...



વ્યક્તિ જીવનપર્યાંત જીવજગતના પ્રપંચોમાં પડેલો કર્મરત રહે છે

જન્મ છે તો મૃત્યુ પણ છે. મૃત્યુ સંસારનું શાશ્વત સત્ય છે. મહર્ષિ વાલ્મીકીએ કહ્યું છે, 'મૃત્યુ જીવન સાથે જ ચાલે છે, તે જીવનની સાથે જ બેસે છે અને સુદૂરવર્તી પથ પર પણ જીવનની સાથે સાથે જ જઈને પાછું આવે છે.' વ્યક્તિ જીવનપર્યાંત જીવજગતના પ્રપંચોમાં પડેલો કર્મરત રહે છે. તે પ્રત્યક્ષપણે તો જીવન જીવતો દેખાય છે, પરંતુ પરોક્ષ રૂપે મૃત્યુ દરેક પળે તેની સાથે રહે છે. આ પ્રકાર આપણે કહી શકીએ છીએ કે મૃત્યુ જીવનનું સહચારી છે. તે જીવનની સાથે આવે છે અને જીવનને સાથે લઈને જ જાય છે. સાંસારિક મનુષ્ય મૃત્યુને ભય માને છે. આખરે એવું કેમ ન હોય? મૃત્યુ તો હંમેશાં ઘૂપા પગલે આવે છે. તે કોઈ ચેતવણી નથી આપતું, બલકે ચૂપચાપ આવીને પોતાના પંજામાં જીવનને જકડી લે છે. એના પર કોઈનું જોર નથી ચાલતું. ઠીક એવી જ રીતે જેમ કોઈ બિલાડી ઘૂપા પગલે આવીને ઉંદરને જકડી લે છે, ત્યારે બિલાડી દ્વારા પકડાયેલો ઉંદરનું કોઈ જોર નથી ચાલતું. ના તેના સાથીઓ કે બંધુ-બાંધવોનું કોઈ જોર ચાલે છે. કેટલાક લોકો એટલા માટે મૃત્યુને ડૂર કરે છે. ભગવાન બુદ્ધ જન્મ-મરણને દુઃખ માને છે. દાર્શનિક આધ્યાત્મિક દૃષ્ટિથી તે આ દુઃખમાંથી નિવૃત્તિનો માર્ગ સૂચવે છે. સંપૂર્ણ ભારતીય દર્શન પણ અમૃતવની વાત કરે છે. તે આત્માની અમરતાની વાત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મૃત્યુને એક વિશ્રામ સ્થળ માને છે. જ્યારે અથર્વવેદ કહે છે કે તમેવ વિદ્વાન ન વિભાય મૃત્યોઃ! અર્થાત આત્માને જાણી લેવાથી મનુષ્ય મૃત્યુથી ડરતો નથી. આત્માની અમરતામાં વિશ્વાસ રાખનાર ભારતીય દર્શન સામાન્યપણે મૃત્યુમાં ભૌતિક શરીરના નાશની વાત કરે છે. જ્યારે સંસારમાં મૃત્યુ બાદ પણ યશ કાયા જીવિત રહે છે. તેથી સાધારણ વૈચારિક દૃષ્ટિકોણથી અપકીર્તિ મૃત્યુ છે. નિસ્પૃહ, આધ્યાત્મિક, પાપ અને વાસના રહિત જીવન જીવીને મૃત્યુના ભયથી મુક્તિ મેળવી શકાય છે. જે જન્મે છે તેનું મૃત્યુ થાય છે. કોઈ દીર્ઘ આયુ વાળો હોય છે તો કોઈ અલ્પ આયુ વાળો હોય છે. કોઈની સુસમયે અર્થાત કે સારું મૃત્યુ થાય છે તો કોઈની અકાળ મૃત્યુ થાય છે. મૃત્યુ કેવી રીતે થશે, કેમ થશે, ક્યાં થશે અને ક્યારે થશે જેવા પ્રશ્નો થવા સહજ છે. મૃત્યુનો ભય બધા જ જીવોનો હોય છે કેમ કે મૃત્યુ સહજ હોય કે અસહજ એ ખૂબજ પીડાદાયક હોય છે. પ્રત્યેક જીવ જન્મજન્મથી આ કષ્ટનો અનુભવ કરતો આવ્યો છે.

શાંત ચિત્તે કોઈ પરમશક્તિનું ધ્યાન કરતાં માનસિક શક્તિને ઉત્તેજન આપવા આપણે જે અને જેવી રીતે કોઈ ક્રિયા કરીએ તે પ્રાર્થના જ છે



બધા જ ધર્મોમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. હિંદુ, શીખ, ઈસાઈ, મુસ્લિમ, જૈન અને બૌદ્ધ - બધા પોતપોતાની રીતે પ્રાર્થના કરે છે. ગાંધીજી પ્રાર્થના કર્યા બાદ જ સુઈ જતા હતા. બધા ધર્માચાર્યો, સંત-મહાત્માઓએ પ્રભુ પ્રાર્થનાને પ્રભાવી માની છે. આધ્યાત્મિક વિભૂતિ દાદા ટી.એવ. વાસવાનીએ પ્રાર્થના પર એક પુસ્તક 'લિટલ બુક ઓફ પ્રેયર' પણ લખ્યું છે. તેમણે પ્રાર્થનાના કેટલાય પ્રકારો જણાવ્યા છે, જેમ કે નિવેદનીય પ્રાર્થના, સામાન્ય પ્રાર્થના, શાંતિ અને સાધનાની પ્રાર્થના વગેરે. તેઓ લખે છે - પ્રાર્થના શુદ્ધ મન અને વિશ્વાસ કરવાથી જ ફળદાયક હોય છે. ભગવાન નિશ્ચલ, નિષ્કપટ અને શુદ્ધ હૃદયવાળા વ્યક્તિની પ્રાર્થના જલ્દી સાંભળે છે. જ્યારે તમે પ્રાર્થના ખતમ કરો છો, તો તમને વિશ્વાસ હોવો જોઈએ કે તમે જે કંઈ માગ્યું છે, તમને આપી દેવાયું છે, ત્યારે તમે તેના માટે ઈશ્વરનું ધન્યવાદ કરી શકો છો. ઉરિયા બાબા કહેતા હતા, 'નિષ્કામ પ્રાર્થના વધુ પ્રભાવી હોય છે. સંત તમામ પ્રાણીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. ગરીબો, અનાથો, વિકલાંગોના કલ્યાણ માટે કરવામાં આવેલી પ્રાર્થના નિષ્કામ હોય છે. વેદોમાં ઈશ્વરને 'સર્વ ભવતું સુખિનઃ' પ્રાર્થના કરવામાં આવી છે. મહર્ષિ અરવિંદ લખે છે, 'ભગવાન પાસે સદ્બુદ્ધિ માગો - સમજો કે બધું જ મળી ગયું.' કેટલાક લોકો પોતાને નાસ્તિક સમજે છે. કદાચ આવા લોકોને પ્રાર્થનાની સૌથી વધારે જરૂર છે. પ્રાર્થનાને અધાર્મિક રીતે જોઈએ તો શાંત ચિત્તે કોઈ પરમશક્તિનું ધ્યાન કરતાં માનસિક શક્તિને ઉત્તેજન આપવા આપણે જે અને જેવી રીતે કોઈ ક્રિયા કરીએ તે પ્રાર્થના જ છે. ધર્મ-ધર્મ તેની રીત બદલાય તો કેટલાક તેને યોગ કહે અથવા અન્ય કોઈ નામ આપે પરંતુ અંતે તો તે એક જ છે. આજના સમયમાં જીવન દોડાદોડી અને માનસિક અશાંતિ ભર્યું બન્યું છે. આ અશાંતિ માણસને ઓછા કાર્યક્ષમ અને જલદી થાકી જતા બનાવે છે. કેટલાક રોગોનું મૂળ પણ આ માનસિક અશાંતિમાંથી જન્મે છે. જીવન વધુ વ્યવસ્થિત અને જીવવા લાયક બનાવવા દરેકે થોડોક સમય ધ્યાન માટે આપવો જોઈએ. પ્રાર્થનાના ચમત્કારિક પરિણામો મળે છે એટલું ચોક્કસ છે. આપણે તેને તે સ્વરૂપમાં સ્વીકારીએ અથવા નહિ તેનાથી તેની અસરોને કોઈ ફરક પડતો નથી. વર્તમાન સમયમાં દુનિયા અશાંતિ, મુશ્કેલીઓ, ટકરાવ અને ઘણી બધી માનવનિર્મિત તથા પ્રાકૃતિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. દરેક માણસને સુખ અને શાંતિ જોઈએ છે અને ઘણીવાર એ મેળવવા કોઈ ખોટા માર્ગ વળી જાય છે. લોકો આવી મુશ્કેલીઓમાંથી નીકળવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે પરંતુ જો એમાં કોઈ અસરકારક ઉપાય હોય તો એ પ્રાર્થના છે. કોઈ કાર્ય અશક્ય લાગતું હોય તેને શક્ય બનાવવાનો અભિગમ અને પ્રેરણા પ્રાર્થના દ્વારા જ મળે છે. ધ્યાન એ આપણા મનને શાંતિ અર્પે છે અને આપણી નિરાશાને આશામાં પરિવર્તિત કરે છે.

દેશ કાળ બદલાય એમ માનવીની જરૂરિયાત પણ બદલાય, અને જરૂરિયાત મુજબ માનસિકતા પણ બદલાય!

આપને તારા અંતરનો એક તાર! રવિન્દ્રનાથ ટાગોરની એ પ્રાર્થના થકી ઈશ્વર સાથે એકાકાર બનીએ!

આપનાં શ્રીચરણોમાં સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. દેશ કાળ બદલાય એમ માનવીની જરૂરિયાત પણ બદલાય, અને જરૂરિયાત મુજબ માનસિકતા પણ બદલાય! આ બધું જ સમયના ચક્રની સાથે સતત ફરતું રહે છે, અને માનવી રોજને રોજ જરૂરિયાતના નામે કેટલીય ઈચ્છાપૂર્તિની માંગણીઓ રૂપી પ્રાર્થના કરતો હોય છે. હકીકતમાં પ્રાર્થના એ એક એવો સૂર છે, જેમાં સ્વ કેન્દ્રિત કોઈ માંગ હોતી નથી. અથવા તો હોય છે, તો પણ પોતાના આત્મ ઉત્થાન માટે, અથવા તો અન્યના સુખ-શાંતિ માટે પ્રાર્થના થતી હોય છે. આ વાત આપણે લગભગ દરેક પ્રાર્થના વખતે કરી જ છીએ, છતાં એકઠો જેટલો ઘુટા ટેટલું વધુ સારું એટલે સહજ. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના પાયામાં ખુબ જ સારી સારી શીખ અને સંસ્કાર રહેલા છે, જેમાં લગભગ બધાને સાથે લઈને ચાલવું એટલે સર્વ હિત સુખાય, કે સર્વ ભવન્તિ સુખી ના.. પણ દેશ કાળ પ્રમાણે માનવીને ઉપરની ઈમારત ખૂબ જ સુંદર આકર્ષક અને ઊંચી યણ્ણી છે, એટલે કે વિકાસને નામે ક્યાં ના ક્યાંય પહોંચવું છે, પણ પાયો મજબૂત હોય નહીં, તો ઈમારત જેમ ભૂખૂંડતી નીચે આવે, એવું જ આપણું પણ છે. એટલે જો વિકાસ સાથે જ કરવો હશે, તો જેમ ઝાડનું જમીન સાથે જોડાણ હોય તો જ એની વૃદ્ધિ છે, એમ આપણે પણ ધરા પર એટલે કે પાયામાં રહેલા સંસ્કાર મુજબ જીવવું પડશે! માત્ર દુઃખ વખતે જ ઈશ્વર યાદ આવે, કે પછી ભૌતિક ભરમારની ભ્રમણા માટે એની પ્રાર્થના કરીએ એ વ્યાજબી નથી. નોબલ પ્રાઈઝ વિજેતા કવિ રવીન્દ્રનાથ

ટાગોરની ભાવના બહુ ઊંચી હતી, અને એને તો ફક્ત ઈશ્વર સાથે જોડાયેલા રહેવું, એવો એક ભાવ વ્યક્ત કરતી પ્રાર્થના. **રવિન્દ્રનાથ ટાગોર આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું, સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું... ટેક તુંબડું મારું પડ્યું નકામું, કોઈ જુએ નહિ એના સામું, બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ઘૂલ જગાવું. ૧ એકતારો મારો ગુંજશે મીઠું, દેખશે વિશ્વ રહું જે અદીઠું, ગીતની રેલશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાગ્યું... આપ.. ૨** કવિ રવિન્દ્રનાથ ટાગોરની આધ્યાત્મિક ઊંચાઈની વાત જ શું કરવી! એની પોતાની અલગ મસ્તી માટે તે ખૂબ જ જાણીતા છે, અને ઈશ્વર સાથે આ રીતે સંવાદ કરવાની એક આદત હતી, અને તેમની આ પ્રાર્થનાનો અનુવાદ શ્રી ભાનુશંકર વ્યાસે કર્યો છે. સાવ સીધા સાદા શબ્દોમાં લખાયેલી આ પ્રાર્થના બતાવે છે કે, પ્રભુને અલંકારિક શબ્દોની એટલે કે પ્રસંસાની એટલી જરૂર નથી, એ તો ભક્તના હૃદયનો ભાવ પરખીને તેની પર પ્રસન્ન થાય છે. કવિની ઈશ્વર પાસે માત્ર એક જ માંગણી છે કે, તારા અંતરનો એક તાર મને આપ! બસ બીજું મને કંઈ જ જોઈતું નથી. મારા અંતરની માત્ર આટલી જ માંગ છે અને એને તું સાંભળજે! પણ

હકીકતમાં પ્રાર્થના એ એક એવો સૂર છે, જેમાં સ્વ કેન્દ્રિત કોઈ માંગ હોતી નથી, અથવા તો હોય છે, તો પણ પોતાના આત્મ ઉત્થાન માટે, અથવા તો અન્યના સુખ-શાંતિ માટે પ્રાર્થના થતી હોય છે



સંદગુરુ વચનામૃત
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારો માં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઘાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું, તારે બોલે હાફળ ફોફળ ચાકર ઉઠે બેસે

બાળ વાર્તાઓ આપણને બાઈલ ના આગમન સાથે લુપ્ત થઈ ગઈ.. હવે વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારના.એમાં વાર્તાઓ નથી રહી કે ભાભો ઢોર ચારતાએ નથી.છતાં આપણી ચિંતન મનન રત્નકણિકા માં આજે એક હતી ચકી અને એક હતો ચકો ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી થાકી મગનો દાણો બંને ભેગા થઈ ખીચડી બનાવી આ વાર્તા નાનપણમાં બહુ ગમતી કૃષિ ઉત્પાદન વધારવા માટે જમીન માં વપરાતા હાઈબ્રીડ બિયારણ રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓ ના કારણે કૃષિ પાકો અને જમીનો ઝેરીલી બની છે જેની સીધી અસર પશુ-પક્ષીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે કેટલાક પક્ષીઓ અને પશુઓ લુપ્ત થઈ ડાયનાસોર સ્વરૂપ બન્યા છે જેને ફક્ત ચિત્રોમાં કે વિડિયો વિડિયો માં જોઈ શકાય છે આ ઝેરીલા બિયારણ ખાતરો રાસાયણિક દવાઓના કારણે માનવી પણ અનેક રોગોનો ભોગ બની રહ્યો છે ગઈકાલે વીસમી માર્ચ -૨૦૨૪ને અંતે બુધવારે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે સંકલ્પ કર્યો કે જમીનમાં શક્ય હોય ત્યાં સુધી સેન્ટ્રિય ખાતરો કુદરતી જીવ જંતુ અને ભગાડે તેવા છંટકાવ કરીશું નહીં ગીધ કાગડા પક્ષીઓ ઘેટા બકરા ગઘેડા જેવા પશુઓ બિલકુલ લુપ્ત થવાના આરે પહોંચ્યા છે આંગણમાં સતત


ચી ચી કરતી ચકલીઓ ક્યાં આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે ચકલી પરિવાર વિશે કંઈક જોઈશું એ પહેલા કવિ રમેશ પારેખે લખેલી અત્યંત હૃદય ની રચના આજે વિશ્વ ચકલી દિને માણી આગળ ચકલી પરિવારને ઓળખવા પ્રયત્ન કરીએ.. તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઘાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું, તારે બોલે હાફળ ફોફળ ચાકર ઉઠે બેસે,મારા ઘરમાં કીડી સુઢા દમામપૂર્વક બેસે. મારે ફળીયે ચૂલે ઝાડની ઘટાદાર ખુશી યારી, ખોલું ત્યા આકાશ લાગવું દેતી ઘરની બારી, જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું. તારે ફળીયે તારો વૈભવ ખોખારાઓ ખાય, મારે પંખીના ટહુકાથી અજવાળા ફેલાય, સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો, હું તો અકડલકડ ડાયરા વચ્ચે મગન યાતો. આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું, તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઘાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું, ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) એક પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાના કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને

ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી ઈલાકા ઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજ ભાષામાં હાઉસ સ્પેરો, સ્પેનિશ સ્પેરો, સિડ સ્પેરો, રસેટ સ્પેરો, ડેડ સી સ્પેરો અને ટ્રી સ્પેરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પેરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગોરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે. ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઈમારતોમાં ચકલી ઓને રહેવા માટે પુરાણી ઢબના ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પસારીની ઢુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણ નથી મળતા. આ ઉપરાંત ખાંભાઈલ ટાવરોમાંથી નિકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે

મારે ફળીયે મૂલે ઝાડની ઘટાદાર ખુશી યારી, ખોલું ત્યા આકાશ લાગવું દેતી ઘરની બારી, જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું



વિશેષ
ચશપાલસિંહ ટી. વાઘેલા (દરબાર ગઝ, વરા)



કવિને ઈશ્વરના અંતરનો એક તાર શું કામ જોઈએ છે? એને વિશે આગળ જણાવતા તે કહે છે કે, તારી સાથે મારું અસ્તિત્વ જોડાયેલું નથી, માટે મારું આ તુમનું પડ્યું નકામું, એટલે કે આ શરીર અથવા જન્મ આમનામ જ વીતી જશે, એની સામે કોઈ જ જોશે નહીં! મને કંઈક વિશેષ કરીને જવું છે કે, જેનાથી લોકો મને હું ન હોવું ત્યારે પણ યાદ કરે! એકવાર તારી સાથે મારું જોડાણ થઈ જાય, તારા અંતરના તાર સાથે મારું આ તુંબડું એટલે કે શરીર અથવા આ જન્મ બાંધીને, હું એક અલગ ધૂન જગાવીશ! એટલે કે તારી સાથે મિલનનો એક નવો માર્ગ રચીશ, જેમાં ફક્ત મસ્તી કે અલગારી પહોંચુ મુખ્ય હશે! કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નહીં હોય. આગળ કવિ લખે છે કે એકતારો મારો ગુંજશે મીઠું! એટલે કે તારા એકતાર સાથે મારા અંતરનો જે એક તાર જોડાયો છે, એ જ માત્ર મને યાદ રહેશે, અને એની મીઠી સ્મૃતિ મારા અસ્તિત્વને તરબોળ કરી દેશે, અને પછી વિશ્વ આખું એ જોશે કે પછી એ નજરથી હું વિશ્વ ને જોઈશ, જે આજ સુધી અદીઠું હતું! કોઈની પણ મારી તરફ દૃષ્ટિ નહોતી, એ મને જોતાં રહી જશે! તારા તાર સાથે જોડાયેલા મારા એક ઉદાહરણ ગીતની અખંડિત એક ધાર રેલાશે! અને એની મસ્તીમાં

એક બાળક છે જેની માતા એને રમકડા વગેરેનું પ્રલોભન આપી પોતાની નિત્ય પ્રવૃત્તિમાં એટલે કે ઘરકામમાં પ્રવૃત્ત થાય છે. કોઈ કોઈ બાળક આ રમકડા જેવા પ્રલોભનોથી લલચાઈને થોડીવાર એની સાથે રમે છે, પરંતુ અંતે એને એની માતા યાદ આવે છે, અને એ તીવ્રાથી એને પોકારે છે! એટલે કે રડવા લાગે છે. કોઈ કોઈ બાળકને તો આ રમકડા આકર્ષિત કરી શકતા નથી અથવા તો એની માતા બાજુમાં હોય તો એ રમકડાથી અવશ્ય રમે છે, એનું સમગ્ર અસ્તિત્વ એની માતા સાથે જોડાયેલું રહે, એવું એ ઈચ્છે છે, અને એને જ્યારે જ્યારે એની માતા એની સાથે હોય ત્યારે એ એકદમ અલગ અલગ જ હોય છે, એટલે કે તેની પ્રસન્નતા પારાવાર હોય છે, અને ત્યારે જ તે કંઈક નવું કરે છે, વિશેષ કરે છે, કે પછી એની ખૂબી પ્રસ્તુત કરે છે. બસ કવિ પણ પોતાના અસ્તિત્વને બાળક જેટલું નાનું બનાવીને, ઈશ્વર સાથે એક અદમ્ય જોડાણ થાય એવું ઈચ્છે છે, અને એટલે તે ઈશ્વરને પ્રાર્થે છે, આપને તારા અંતરનો એક તાર... આપણે પણ આપણો આ જન્મ નકામો ન જાય એવું ઈચ્છતા હોઈએ, તો આ ભૌતિકતાની ભરમારમાંથી બહાર આવી, ઈશ્વરની સાથે એકતારો જોડવા આ પ્રાર્થનાનો સહારો લઈએ, અને કવિ રવિન્દ્રનાથની થોડી મસ્તીને આપણે પણ અનુભવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.



સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી ઈલાકા ઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજ ભાષામાં હાઉસ સ્પેરો, સ્પેનિશ સ્પેરો, સિડ સ્પેરો, રસેટ સ્પેરો, ડેડ સી સ્પેરો અને ટ્રી સ્પેરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પેરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગોરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે. નર ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) એક પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાના કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને

ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી ઈલાકા ઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજ ભાષામાં હાઉસ સ્પેરો, સ્પેનિશ સ્પેરો, સિડ સ્પેરો, રસેટ સ્પેરો, ડેડ સી સ્પેરો અને ટ્રી સ્પેરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પેરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગોરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે. ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઈમારતોમાં ચકલી ઓને રહેવા માટે પુરાણી ઢબના ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પસારીની ઢુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણ નથી મળતા. આ ઉપરાંત ખાંભાઈલ ટાવરોમાંથી નિકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે

હાનિકારક માનવામાં આવે છે. આ તરંગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઈ રહી છે. ચકલીને ખોરાક તરીકે ધાસના બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ભેત્રો માં આસાનીથી મળી જાય છે. વધારે તાપ માન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપ માન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચકલી નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે. છેલ્લે એ જ તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઘાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું, તારે બોલે હાફળ ફોફળ ચાકર ઉઠે બેસે

નાના ભાગલિયા ગામે શ્રીમદ્ ભાગવત કથા....



તસ્વીર : ભરતભાઈ પંડ્યા, દિવાડા કોલોની

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નાના ભાગલિયા ગામે તા.૧૯-૦૩-૨૪ થી ૨૩-૦૩-૨૪ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન તાલુકા ગાયત્રી પરિવાર તેમજ શ્રી લક્ષ્મણભાઈ રામાભાઈ માલીવાડ દ્વારા તેઓના માતૃશ્રી સ્વ. કાળીબેન રામાભાઈ માલીવાડ ની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવેલ છે...

અમરાઈવાડી વિસ્તારમાં વિવિધ સ્થળોએ 'મતદાન જાગૃતિ' અંગેના કાર્યક્રમો યોજાયા

મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા તથા અચૂક મતદાનના શપથ લેવડાવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શનમાં કરાયું આયોજન

અમદાવાદ, તા.૨૦

અમદાવાદ પશ્ચિમ લોકસભાના અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શનમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું...



જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી...

જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અનેક સ્થળોએ ઉપસ્થિત સૌ લોકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાના શપથ લીધા હતા...

દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા લોકસભા અંતર્ગત ઝાલોદની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

ઝાલોદ, તા.૨૦

દાહોદ જિલ્લાનાં ઝાલોદની સરકારી સાઈન્સ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪. જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા ઝાલોદ ની સરકારી સાઈન્સ કોલેજ ખાતે EVMs, VVPATs and PB સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું...



તસ્વીર : પંકજ પંડિત, ઝાલોદ

EVMs, VVPATs and PB Strong Room ની મુલાકાત લેવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદાન સમયે કોઈપણ રીતે કોઈ કચાશ ન રહી જાય તે માટે પણ તૈયારીઓ ચાલી રહી છે...

બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં એસ.એસ.સી./ એચ.એસ.સી. પરીક્ષા લેવાઈ રહી છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૪થી ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ જેમાં બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીની સીધી દેખરેખમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાઈ રહી છે...

એકલવ્ય પ્રવેશ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સંપૂર્ણ પરીક્ષાની તૈયારી કરાવવા ત્યુ પાર્થ તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા



તસ્વીર : પંકજ પંડિત, ઝાલોદ

સંજેલી તાલુકામાં આવેલ જ્ય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે.

સંજેલી તાલુકામાં આવેલ જ્ય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા તેમજ P.S.E. ચિત્રકામ, N.M.M.S જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે...



જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. દિલીપ કુમાર મકવાણા એ જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારમાં કોઈ અનાથ બાળક હોય અને તેમને એકલવ્ય પ્રવેશ પરીક્ષા આપવાની હોય તો તેમને વિનામૂલ્યે જરૂરી મટીરીયલ, તાલીમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું...

રૂની જૈન તીર્થ ખાતે શ્રી માણી ભદ્રવીર તથા જીવદયા દેવીની પ્રતિષ્ઠા અને નુતન પાંજરાપોળનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો



તસ્વીર : યશપાલસિંહ ટી. વાઘેલા, થરા

કાંકરેજ તાલુકાના ૧૦૮ પાર્થનાથ જૈન રૂની તીર્થ ખાતે ગાંધી દેવીલાલેખેન સુરેશકુમાર ખોડા દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટ રૂની દ્વારા આગામી તારીખ ૧૯/૦૩/૨૪ થી ૨૦/૦૩/૨૪ એ પ્રતિષ્ઠા તથા ઉદ્ઘાટન સમારોહ સુધી જય ઘોષ પટ્ટધર સંઘ શાસક કૌશલ્યાધાર પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જય સુંદરસૂરીશ્વર જી મહારાજ સાહેબ આદીકાળા ની પાવન નિશામાં યોજાયો.

તથા ટીમનો લોક ડાયરો મોજ કરાવી હતી. બીજા દિવસે ગઈકાલે સવારે તારીખ ૨૦/૩/૨૦૨૪ રોજ સવારે કુંભ સ્થાપન બાદ જીવદયા દેવી અને માણીભદ્રવીર ની મૂર્તિ સ્થાપના અને પ્રતિષ્ઠા થયા બાદ પાંજરા પોળનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ધીરજભાઈ શાહ, સુરેશ ભાઈ ગાંધી, સુરેશભાઈ શાહ વાટી, અક્ષયકુમાર મહેતા, દિનેશ ભાઈ ધાણધારા, ડો. હેમરાજભાઈ પટેલ યશપાલસિંહ ટી વાઘેલા, જીતુભાઈ ધાણધારા, રોહિતભાઈ શાહ, અજીતભાઈ ધાણધારા, ચીનુલાલ ગુંજરિયા, મુકેશકુમાર સુરાણી, ચીનુલાલ શાહ, શૈલેષ ભાઈ શાહ, દલપત લાલ શાહ, નીતિનભાઈ ગાંધી, યજ્ઞેશભાઈ ગાંધી તથા મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ હાજર રહી ઉદાર હાથે દાન આપેલ. કાંકરેજ તાલુકામાં અબોલ જીવો માટે અદ્યતન સગવડવાળી પાંજરાપોળ ખુલી મુકતાં જીવદયા પ્રેમીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ભાવનગરમાં દીપડાનો ફહેર, ૧૨ ઘેટાને ફાડી ખાધા

ભાવનગર, તા.૨૦

ભાવનગરમાં દીપડાનો આતંક વધતો જોવા મળ્યો છે. પાલિતાણાના રાજવાડી વિસ્તારમાં દીપડાએ ગત રાત્રિએ ૧૨ ઘેટાને ફાડી ખાધા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી સ્થાનિકો ભયભીત થયા છે. સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં વન્યાણીના આંટાફેરા વધી ગયા છે. તેમના સીમાક્ષેત્રમાંથી બહાર નીકળી શિકાર શોધવા નજીકના ગામોમાં, રહેણાંક વિસ્તારોમાં આતંક મચાવતા જોવા મળ્યા છે. ઉપરાંત, આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થયા છે. ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી વગેરે જીલ્લાઓમાં દીપડાઓનો આતંક જોવા મળ્યો છે.

આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (અ,વ,ઇ) :

આજના દિવસે તમારામાં ઊર્જાની વિપુલતા હશે-પણ કામનું દેખાણ બેચેન કરી નાખે એવું જણાય છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. દિવસના ઉત્તારાધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે. પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઈટમાં ભોજન શરૂ કરશો. આઈટી પ્રોફેશનલ્સને તમનું કૌતવ દેખાડવાની તક મળશે.

વૃષભ (બ,વ,ઇ) :

આજના દિવસે તમારું વ્યક્તિત્વ આજે અતરની જેવું કામ કરશે. આજે તમારા ઓફિસ માં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાન નું ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે.

મિથુન (ક,ઇ,ઇ) :

આજના દિવસે તમારું શારીરિક સાર્થક જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે.

કર્ક (ડ,ઇ) :

આજના દિવસે જો લોકો માન કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભય પુશી તથા મોજમજા. આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આના થી બચો. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યાં અને હિંમતવાન બનો.

સિંહ (મ,ઇ) :

આજના દિવસે ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. આર્થિક જીવન ની સ્થિતિ આજે સારી નહિ કહી શકાય? જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હારસ્યનો કોઈ અવાજ નથી.

કન્યા (પ,ઇ,ઇ) :

આજના દિવસે આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું હોવે તો ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારો વિનોદી એવમ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે. પ્રિયતમ આજે તમારી પાસે થી કંઈ માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે.

તુલા (ર,ઇ) :

આજના દિવસે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. આજે તમે તમારા પ્રયત્ન ત્રના હૃદયના ધડકાર સાથે સાથે મિલાવશો.

મકર (બ,ઇ) :

આજના દિવસે એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનાં સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે.

ધન (ભ,ઇ,ઇ) :

આજના દિવસે અન્યો સાથે પુશી લેવંચથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં-તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે.

મકર (બ,ઇ) :

આજના દિવસે એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનાં સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે.

કુંભ (ગ,ઇ,ઇ) :

આજના દિવસે તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો? મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારું નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે.

મીન (દ,ઇ,ઇ,ઇ) :

આજના દિવસે અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. જેઓ સંવેદનશીલ પુનરાચ્છાસન શોધી રહ્યા છે તેમની મદદ તેમના વડીલો આવશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાના નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે.

ટોળાએ મંત્રીને ઉમેદવારી માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશવા ન દીધા

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦ । લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી અને વિવાદ અને નેતાઓના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યારે ટોળાએ મંત્રી પર એટલો ગુસ્સો કર્યો કે તેઓએ ઉમેદવારી નોંધાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશવા પણ ન દીધા અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. વાત ૧૯૮૧ની છે જ્યારે દેશમાં ૧૦મી લોકસભાની ચૂંટણી મે-જૂનમાં યોજાવાની હતી. આ મધ્યસ્ત્ર ચૂંટણી હતી કારણ કે ૧૯૮૮ની ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીઓ બાદ વીપી સિંહે અગાઉ ભાજપની મદદથી રાષ્ટ્રીય મોરચાની સરકાર બનાવી હતી. આ સરકારનું જનતા દળ નેતૃત્વ કરી રહ્યું હતું. મંડલ કમિશનની ભલામણો લાગુ કર્યા બાદ અને ઓબીસીને ૨૭ ટકા અનામત આપ્યા બાદ ભાજપે દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું હતું. તત્કાલીન ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રામ રથયાત્રા કાઢી હતી. જ્યારે અડવાણીની યાત્રા બિહારના સમસ્તીપુર પહોંચી ત્યારે લાલુ યાદવની જનતા દળ સરકારે ભાજપ નેતાની ધરપકડ કરી લીધી હતી. આનાથી નારાજ ભાજપે જનતા દળના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર એટલે કે વીપી સિંહની સરકાર પર નિશાન સાધ્યું હતું અને પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. આ કારણે વીપી સિંહની સરકાર પડી ગઈ હતી.

આ પછી, ચંદ્રશેખર ૧૯૯૦ની નવેમ્બરે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સમર્થનથી વડાપ્રધાન બન્યા હતા. નોંધનીય છે કે ચંદ્રશેખરે થોડા દિવસો પહેલાં ૬૪ સાંસદો સાથે જનતા દળથી અલગ થઈને નવી સમાજવાદી જનતા પાર્ટીની રચના કરી હતી. હજુ તો ચંદ્રશેખરની સરકારે માત્ર ત્રણ મહિના અને ૨૪ દિવસ પૂરા કર્યા હતા ત્યાં જ કોંગ્રેસ, જેણે સરકારને બહારથી ટેકો આપ્યો હતો, તેણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર જાસૂસી કરવાનો આરોપ લગાવીને પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. જેના કારણે ચંદ્રશેખર સરકારે બહુમતી ગુમાવવી દીધી હતી અને ચંદ્રશેખરે ૧૯૯૧ની છઠ્ઠી માર્ચે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી દેશમાં દસમી લોકસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગ્યું હતું. ચંદ્રશેખરની સાથે, જનતા દળમાંથી સમાજવાદી જનતા પાર્ટીમાં પણ પલટો કરનારાઓમાં હુકુમદેવ નારાયણ યાદવ પણ હતા, જેઓ ૧૯૮૮માં બિહારના સીતામઢીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ચંદ્રશેખરે યાદવને કાપડ મંત્રી બનાવ્યા હતા. જો કે જ્યારે ૧૯૯૧માં જ્યારે ફરીથી ચૂંટણીઓ થઈ રહી હતી.

દેશમાં ચૂંટણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં । અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણો ખર્ચ હશે ભારતની ૨૦૨૪ની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ, ૧.૨૦ લાખ કરોડનો ખર્ચ થશે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦ । લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાતી લોકસભાની આ ચૂંટણી વિશ્વની તમામ ચૂંટણીઓ કરતા સૌથી ખર્ચાળ સાબિત થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પાછળ આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી શકે છે. જે અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણા હશે. રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે. તેથી આ ચૂંટણીમાં પાણીની જેમ રૂપિયા વહાવવામાં આવશે.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ તેમજ એડીઆર દ્વારા લોકસભાની ચૂંટણી પાછળ વિવિધ રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ દ્વારા થનારા અનુમાનિત ખર્ચના આંકડા જાહેર કર્યા છે. મીડિયા સ્ટડીઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જો આટલો ખર્ચો થશે તો ભારતની આ ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ સાબિત થશે. એટલું જ નહીં પાંચ વર્ષમાં ચૂંટણી પાછળનો ખર્ચો બમણો થવા જઈ રહ્યો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પાછળ ૬૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવાનું અનુમાન સામે આવ્યું હતું. જ્યારે ૨૦૧૪માં આ આંકડો ૩૦ હજાર કરોડ રૂપિયા હતો. એટલે કે દર પાંચ વર્ષે ખર્ચનો આંકડો બમણી ગતિએ આગળ વધી રહ્યો છે.

રાજ્ય સરકાર ઉદાવે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર દેશમાં પ્રથમ વખત જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે તેનો ખર્ચ માત્ર ૧૦.૪૫ કરોડ રૂપિયા આવ્યો હતો. ૨૦૦૪માં આ આંકડો પ્રથમ વખત એક હજાર કરોડ રૂપિયાને પાર પહોંચ્યો હતો. તે સમયે ૧૦૧૬ કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો. બાદમાં ૨૦૦૮માં આ રકમ ૧૧૧૫ કરોડ રૂપિયા પર પહોંચી હતી. તેથી ૨૦૦૪થી ૨૦૦૮ દરમિયાન કોઈ મોટા ફેરફાર ખર્ચામાં જોવા નહોતા મળ્યા. પણ ૨૦૧૪ બાદ લોકસભાની ચૂંટણી પાછળ થતો ખર્ચો બમણી ગતિએ વધી રહ્યો છે. જ્યારે અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના રિપોર્ટમાં રાજકીય પક્ષોના ખર્ચાની તેમજ મેળવેલા ફંડની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી સમયે તમામ રાજકીય પક્ષોએ મળીને ૬૪૦૫ કરોડ

રૂપિયાનું ફંડ મેળવ્યું હતું જ્યારે ૨૫૯૧ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. રિપોર્ટ અનુસાર સાત રાષ્ટ્રીય પક્ષોએ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ૫૫૪૪ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા જેમાં માત્ર ભાજપને જ ૪૦૫૭ કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૧૧૬૭ કરોડ રૂપિયા મળ્યા હતા. તેની સામે ખર્ચો પર નજર કરીએ તો ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૧૧૪૨ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોવાના આંકડા જાહેર કર્યા હતા, જ્યારે કોંગ્રેસના ખર્ચની રકમ ૬૨૬ કરોડ રૂપિયા હતી.

ભાજપે ૩૦૩ બેઠકો પર જીત મેળવી હતી, તે જોતા તેને એક બેઠક સરેરાશ પોણા ચાર કરોડ રૂપિયામાં પડી હતી. કોંગ્રેસે બાવન બેઠકો મેળવી હતી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે, જેમાં ચૂંટણી પંચના ખર્ચનો હિસ્સો માત્ર ૨૦ ટકા



તામિલનાડુના સીએમ અને ડીએમકેના વડા એમકે સ્ટાલિન પદના નેતા કનિમોગી સાથે ચેન્નાઈમાં પાર્ટીની બેઠક દરમિયાન પદના ઉમેદવારોની યાદી અને ટંદેરો જાહેર કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીને લઈને સરકારનો નિર્ણય યુપીએસસીનો સિવિલ સર્વિસિસની પ્રિલિમનરી પરીક્ષા સ્થગિત કરવા નિર્ણય

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦ । લોકસભા ચૂંટણી ૨૦૨૪ને કારણે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ સિવિલ સર્વિસિસની પ્રિલિમનરી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણીના શેડ્યુલ જાહેર થયા પછી, યુપીએસસીએ જી.ઈ.ઈ.ઈ. પર એક નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે ગયા શુક્રવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪નું શેડ્યુલ જાહેર કર્યું હતું. લોકસભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી સાત તબક્કામાં યોજાશે. ૪ જૂને મરગણતરી થશે. જ્યારે યુપીએસસીની પરીક્ષા ૨૬ મેથી શરૂ થવાની હતી. યુપીએસસીએ આ દરમિયાન લેવાનારી પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કમિશન દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "જનરલ ઈલેક્શન શેડ્યુલના કારણે, પંચે સિવિલ સર્વિસિસની પ્રિલિમનરી પરીક્ષા - ૨૦૨૪ને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, જે ૨૬-૦૫-૨૦૨૪ થી ૧૬-૦૬-૨૦૨૪ દરમિયાન ભારતીય વન સેવા યોજાવાની હતી.

આરોપી જાવેદ એન્કાઉન્ટરમાં ઠાર ચુપીના બદાર્યમાં બે બાળકોની કુહાડીથી ગળુ કાપી હત્યા

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦ । ચુપીના બદાર્યમાં બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ કુહાડી વડે નિર્દોષ લોકોની હત્યા કરી હતી. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી છે. વિસ્તારમાં તણાવ છે અને પોલીસ ફોર્સ તૈનાત છે. ડબલ મર્ડરનો આરોપી જાવેદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બરેલીના રાકેશ કુમારે જણાવ્યું હતું કે, આજે સાંજે એક દુર્ભાગ્ય પૂણે ઘટના બની હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો

હતો. આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં આરોપીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપી ૨૫-૩૦ વર્ષનો હતો. રાકેશ કુમારે કહ્યું કે જ્યારે પોલીસને માહિતી મળી તો તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ગુનેગારનો પીછો કરવામાં આવ્યો હતો. ગુનેગારે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વઅચારમાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સાથે આઈજીએ જણાવ્યું કે બંને બાળકો ટેરેસ પર રમતા હતા. દરમિયાન, ગુનેગાર ત્યાં આવ્યો અને બાળકની હત્યા કરી. ગુનેગાર

વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ મુદ્દે બદાઉના ડીએમ મનોજ કુમારે કહ્યું, "આજે સાંજે માહિતી મળી હતી કે બાબા કોલોનીમાં એક યુવકે એક ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યો હતો. કેટલાક લોકો આના પર ગુસ્સે થયા હતા. તેમને સમજાવીને ભુલાવવામાં આવ્યા હતા." પોસ્ટમોર્ટમ માટે લાશ. તેમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર આશરે ૧૧ વર્ષ અને છ વર્ષની હતી. હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. આ તપાસનો વિષય છે.

ભારતીય રેલવેની નવી સુવિધા રૂપિયા નહીં હોય તો પણ સ્ટેશન પર ટિકિટ મળશે

ડિજિટલ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને આગ્રા ડિવિઝને આગ્રા કેન્ટોનમેન્ટ સ્ટેશન પર આ ખાસ સુવિધા શરૂ કરી છે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦ । ક્યારેક તમે રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મુસાફરી કરવા પહોંચી જાવ છો અને ટિકિટ લેવા માટે બિસ્સામાં ઢાથ નાખી દો છો, તો તમને લાગે છે કે તમે પર્સ કે પૈસા રાખવાનું ભૂલી ગયા છો. આ સંજોગોમાં હવે શું થશે તે અંગે તમારે મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. કેવી રીતે પૂર્ણ થશે યાત્રા? આવા લોકોને રાહત આપવા માટે ભારતીય રેલવેએ નવી

વ્યવસ્થા શરૂ કરી છે. આ અંતર્ગત મુસાફર પોતાના બિસ્સામાં પૈસા ન હોય તો પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને આગ્રા ડિવિઝને આગ્રા કેન્ટોનમેન્ટ સ્ટેશન પર આ ખાસ સુવિધા શરૂ કરી છે. આ વ્યવસ્થા હેઠળ જો કોઈ વ્યક્તિ પાસે પૈસા ન હોય તો પણ યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી નહીં આવે. કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે, ક્યૂઆર કોડ દ્વારા અનરિઝર્વેડ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા એક ખાસ કેશલેસ કાઉન્ટર દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં ક્યૂઆર કોડ સ્કેનર સાથેનું એક ફેર ડિસ્કલે પણ લગાવવામાં આવ્યું છે, જેમાં મુસાફરો સ્કીન પર પોતાનું ભાડું જોઈ શકે છે અને ઓનલાઇન ચુકવણી કરી શકે છે.

વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ ટ્રિક ઉત્પાદક રસના દ્વારા અમિનેટ્રી તમન્ના ભાટિયાને તેમના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત આ નવું કેમ્પેઇન રસના ના ભાવનાત્મક સ્પર્શ તેમજ વિટામિન્સ અને મિનરલ્સના કાર્યાત્મક લાભોને પ્રકાશિત કરે છે



। અમદાવાદ, તા.૨૦ । ઉનાળો આવી ગયો છે અને અમે એ જાણીએ છીએ કારણ કે રસનાની નવું કેમ્પેઇન માઈટમાં આવી ગઈ છે !! દર વર્ષની જેમ આ વર્ષે પણ રસના એક નવી નવી ઝુંબેશ સાથે બહાર આવી છે જે તેમના ૨૧ વિટામિન્સ અને મિનરલ્સને હાઈલાઈટ કરવાના સાથે સાથે આપણને જે લાગણીઓ જે તે પ્રેમ, ખુશી, જોશ અને સફળતાના વિટામિન્સ જેવી જગાડે છે એમને પણ હાઈલાઈટ કરે છે. ઊંડા બજાર સંશોધન અને બ્લાઈન્ડ પ્રોડક્ટ સ્વાદના પરિણામોના આધારે, રસનાને વાસ્તવિક ફળોના અર્ક સાથે

વિટામિન, મિનરલ અને ગ્લુકોઝ પીણા તરીકે સુધારેલ છે. નવી જાહેરાત રસના ના ગ્રાહકો અને તેમની ચિકિત્સાતી જરૂરિયાતોને સમજવામાં મદદ કરવા માટે સમગ્ર ભારતવર્ષમાં કરવામાં આવેલા વ્યાપક બજાર સંશોધનનું પરિણામ છે. તે SEC A અને B ઘરો તરફ લક્ષિત કુદરતી, સ્વચ્છ અને ઉત્તમ સ્વાદના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને સ્વાદિષ્ટ, ગાઢ અને આરોગ્યપ્રદ પીણા તરીકે સ્થાન આપે છે જે તર્કસંગત પાસાઓને સંતોષે છે તેમજ ઉર્જા, જોશ, ખુશી, અને સૌથી મહત્વપૂર્ણ વિટામિન, વિટામિન લવ.પ્રદાન કરવામાં ઉમેરક તરીકે કામ કરે છે.

AIIMSમાં ટેકનીકથી સારવાર કરવામાં આવશે હવે ૩૦ મિનિટમાં આંખનાં કેન્સરની સારવાર થઈ જશે

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એક નવી ટેકનોલોજી આવી છે જેના દ્વારા આંખના કેન્સરની સારવાર સરળતાથી કરી શકાય છે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૨૦ । કેન્સરની બીમારી હવે સામાન્ય બની ગઈ છે. કેન્સરના ઘણા પ્રકાર છે, તેમાંથી એક મેલાનોમા કેન્સર છે જે આંખના કેન્સરમાં સામાન્ય છે. ડોક્ટરોની ટીમ હવે આ રોગોથી છુટકારો મેળવવાના ઉપાયો શોધવા સતત પ્રયાસો કરી રહી છે. આવો જ એક સમાચાર દિલ્હીની AIIMS હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. જ્યાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગામા નાઈક સર્જરીની મદદથી હવે આંખના કેન્સરથી પીડિત દર્દીઓની આંખોની રોશની બચાવી શકાય છે.

આંખના કેન્સરના ઘણા પ્રકારો છે, જેમાં મુખ્ય મેલાનોમા કેન્સર છે. આ કેન્સર આંખોમાં જોવા મળતા કોષોને અસર કરે છે. આંખની કીકીમાં જોવા મળતા કેન્સરને ઈન્ટ્રાઓક્યુલર કેન્સર કહેવાય છે. તેના ઘણા લક્ષણો છે, જેનાં શરૂઆતનાં લક્ષણો છે - અસ્પષ્ટ દ્રષ્ટિ,

જ કરવામાં આવશે. આ સારવારની ફી ૭૫ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફી પછી, આંખી હંદગી ફોલોઅપ ફી રહેશે. આટલું જ નહીં આયુષ્માન ભારત અને બીપીએલના દર્દીઓને અહીં મફત સારવાર મળી રહી છે. ગામા નાઈક એક મશીન છે, જે એમઆરઆઈ મશીન જેવું જ છે. આ મશીનની મદદથી હવે આંખના કેન્સરની સારવાર આંખોમાં કોઈપણ ચીરા કર્યા વિના માત્ર ટાંકો લગાવીને કરી શકાય છે. ઘણી વખત આંખના કેન્સરની સારવાર દરમિયાન દર્દીની આંખોની રોશની ઘટી જાય છે, પરંતુ હવે આ થેરાપી દ્વારા આંખોની રોશની બચાવી શકાય છે, તે પણ કોઈપણ સર્જરી વગર. આ ટેકનિક દર્દીની આંખોમાંથી ૨૦૦ કિરણો વડે ગાંઠને શોષીને મારી નાખે છે. આ ટેકનિકથી દર્દીઓને ઘણી રાહત મળશે. તમને જણાવી દઈએ કે આ થેરાપીમાં માત્ર અડધા કલાકમાં સારવાર પૂરી થઈ જાય છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભરે ઉજવણી



। અમદાવાદ, તા.૨૦ । ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીના નેચર ક્લબ ઈકો લાઈફ દ્વારા ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'સ્પેરો મેન' તરીકે જાણીતા જગત કિંબાલવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ તથા અન્ય પરિબળોને કારણે ચકલી સહિતના પક્ષીઓ અને અન્ય જીવોને થતા નુકસાન વિશે વાત કરી હતી. તેમણે પર્વાવરણમાં ચકલી સહિતના દરેક જીવોનું મહત્વ અને તેમના સંરક્ષણ માટેના ઉપાયો વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં તેઓએ વિદ્યાર્થીઓને એનિમલ એન્થમ થકી આ જીવોના સંરક્ષણ અર્થેનો સંદેશ પાઠવવાની પ્રતિજ્ઞા લેવાડાવી હતી.

આ ઉપરાંત સહભાગી વિદ્યાર્થીઓએ 'ચકી બેન ચકી બેન' ગીત ગાઈ ચકલીઓને ફરીથી પોતાના ઘરે આવવા માટે આમંત્રિત કરી હતી તથા 'Save Sparrow, Save Birds' જેવા સ્લોગન રાઈટિંગ કરીને પોતાના મનના પ્રતિભાવ જણાવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને ચકલી ઘરનું ધણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાલુપુર પ્રાથમરી સ્કૂલ, આચાર્ય એકેડેમી, ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ફોર એજ્યુકેશન સેન્ટર તથા ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગાંધીનગરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહત્વનું છે કે ગુજરાત સાયન્સ સિટી અવિરત પણે આવા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.

ન્યુઝ બોક્સ

રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો દૂર કરાયા

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ | National Grievance Services Portal પર તા.૧૬/૦૩/૨૦૨૪થી આજદિન સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની ૯૮૪, મતદારયાદી સંબંધિત ૬૮, મતદાર કાપલી સંબંધિત ૨૦ તથા અન્ય ૩૨૧ મળી કુલ ૧,૩૫૧ ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્થ લાઈન નંબર ઉપર તા.૧૬/૦૩/૨૦૨૪થી આજદિન સુધીમાં કુલ ૮ ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે-સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઈલ મારફતે મીડીયા સંબંધિત ૮, રાજકીય પક્ષો લગતી ૧ તથા અન્ય ૪૨ સામાન્ય મળી કુલ ૫૧ ફરિયાદો મળી છે. વધુમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ ૧,૪૭,૧૯૫ તથા ખાનગી મિલકતો પરથી કુલ ૫૪,૯૨૪ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

કોંગ્રેસે ગુજરાતના વધુ સાત ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ | લોકસભા ચૂંટણી ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ ૭ ઉમેદવારો જાહેર કર્યા હતા અને હવે તેણે વધુ ૭ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા છે. ગુજરાત લોકસભા બેઠકો માટે નવા ૭ ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઈ શકે છે. તેમાં આણંદથી અમિત ચાવડા, પાટણથી ચંદનજી ઠાકોર, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીની ચૂંટણી મેદાને ઉતારવામાં આવે તેવી ભરપૂર શક્યતા છે. જોકે હજુ આ મામલે કોઈ પુષ્ટી થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ૭ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા હતા. બે બેઠક આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને તેને પણ ફાળવી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ ૨૨ નામો જાહેર કરી ચૂક્યો છે અને તેણે પણ ૪ ઉમેદવારોના નામ ફાઈનલ કરવાના બાકી છે.

સરખેજમાં રાત્રી દરમિયાન સુધ રહેલા યુવક પર અજાણ્યા શખસનો જાનલેવા હુમલો

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ | સરખેજ વિસ્તારમાં આવેલા સરખેજ એસ્ટેટ નજીક રાત્રી દરમિયાન ૨૩ વર્ષીય યુવક સુતો હતો. દરમિયાનમાં બુધવારે સવારમાં ૪ વાગ્યાની આસપાસ અજાણ્યો શખસ આવ્યો અને તેને આ યુવકને માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા માર્યો હતો. આ અંગે સરખેજ પોલીસે હત્યાની કોશીલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળ ઉત્તરપ્રદેશ અને હાલ વેજલપુર ખાતે આવેલા પુરુષુ રોહાઉસ આસીફ શેખ પરિવાર સાથે રહે છે. એકતા હોટલ પાસે ભંગારની દુકાન ધરાવી વેપા કરે છે. આસીફનો નામો ભાઈ આદીલ સરખેજ સરખેજ એસ્ટેટ ખાતે બજાજ સ્ટીલ નામની કંપની સામે ભંગારનો વેપાર કરે છે. ગત ૧૯મી માર્ચના રોજ આદીલના મિત્રને જણાવ્યું હતું કે, સવારે આદીલ અને વિરેન ચા પીવા માટે ગયા હતા અને સવારે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. લોહી લુહાણ હાલતમાં તે ખાટલામાં પડ્યો હતો.

દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ગંદકીનો મામલો

ગુજરાત હાઇકોર્ટની ફટકાર અને આકરા વલણ બાદ હવે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની કડકાઈથી અમલવારી કરાવવા સરકાર દ્વારા પર જેટલા અધિકારીઓને એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. બીજાબાજુ, તા.૨૪ એપ્રિલ સુધીમાં ઝોનલ માસ્ટર પ્લાન તૈયાર કરવાની સરકાર તરફથી હેયાધારણ હાઈકોર્ટ સમક્ષ અપાઈ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂઢા માયાની ખંડપીઠે જૂનાગઢ કલેક્ટરને પ્રગતિ અહેવાલ સાથેનું સોંઘનામું રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી મે મહિનામાં મુકરર કરી હતી. જો કે, કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની રજૂઆત બાદ થોડા દુ:ખ સાથે ટકોર કરી હતી કે, સરકાર અને સત્તાવાળાઓ દ્વારા હવે

પર જેટલા અધિકારીઓને એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકેની વિશેષ જવાબદારી સોંપાઈ

જ કેમ બધી કામગીરી અસરકારક રીતે કરવામાં આવી...? એનો મતલબ એ થયો કે, અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. બહારથી આવતાં લોકો-પ્રવાસીઓ ગિરનાર અભયારણ્યને ખરાબ કરીને જાય છે તેવી ટકોર સાથે પણ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. ગિરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઈ એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલમાં રાજ્ય સરકાર તરફથી આજે સોંઘનામું રજૂ કરી જણાવવાનું હતું કે, ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ સહિતના મુદ્દે હાઈકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર અને સત્તાવાળાઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેમાં તા.૨૩ ફેબ્રુઆરીથી તા.૧૫ માર્ચ સુધીમાં વનવિભાગ દ્વારા ૧૧૪ જેટલી પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સત્તાવાળાઓ અને અધિકારીઓએ સ્થાનિક દુકાનદારો સાથે બેઠકો યોજી તેઓને પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ અને તેની અમલવારી પરત્વે સમજાવવા છે. જે દુકાનદારો હજુ પણ પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે, તેઓની સામે સીલોંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર તરફથી હાઈકોર્ટનું એ પણ મહત્વના મુદ્દે ધ્યાન દોરાવું કે, ઈકો સેન્સીટીવ ઝોન માટે ઝોનલ માસ્ટર પ્લાન આગામી દિવસોમાં તૈયાર કરી અમલવારી કરાશે. આગામી ચાર સપ્તાહમાં આ ઝોનલ માસ્ટર પ્લાન તૈયાર થઈ જવાની સંભાવના છે. અલબત્ત, ભવનાથ મંદિર અને અંબાજી મંદિર અભયારણ્યની અંદર આવેલા ડોવાથી કામગીરી થોડી પડકારજનક હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારને જણાવ્યું હતું કે, આ તો માત્ર કામગીરીની શરૂઆત છે.

વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય વીર નર્મદ દક્ષિણ યુનિ. એ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કર્યો

ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે

1 (એજન્સી) સુરત, તા.૨૦ | અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં સામાજિક તત્વો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી માં બનેલી આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરની યુનિવર્સિટીઓમાં જોવા મળ્યા છે. જેના કારણે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં પૈ ૫ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે સુરત પોલીસ સાથે સંકલનમાં રહી યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ માટે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ



પ્રકારની ઘટના ન બને તે માટે યુનિવર્સિટીની સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ-રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં જો આ પ્રકારની ઘટના બને તો તેવા સમયે કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી જીવલેણ હુમલાની ઘટનાને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે. જ્યાં મહત્વપૂર્ણ નિર્ણય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લેવાની ફરજ પડી છે. યુનિવર્સિટીના કુલપતિના આદેશ બાદ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના મુખ્ય દ્વાર બહાર ઈન અને આઉટ કરતા વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટીમાં બહારની અજાણી વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

અમરાઈવાડીમાં અદાવતમાં યુવક ઉપર છરી વડે હુમલો

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ | શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અગાઉના જઘડાની અદાવતમાં યુવક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવક લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે યુવકના પિતાએ અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ૪૦ વર્ષીય ફુલચંદભાઈ શ્યામલાલ ચૌહાણ પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૮મીના રોજ રાત્રે ફુલચંદભાઈ જમી ઘરે ઘાજર હતા. ત્યારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે તેમના દીકાર ઋત્વીકના મિત્ર આશીક તથા ચોબે ઘર પાસે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઋત્વીકને ગાંધીનગર પાસે આવેલ ગામમાં રહેતા કરણસિંહ રાજપુતે ચાકુ માર્યું છે તેથી તાત્કાલીક આવી જાવ. જેથી પિતા સહિત પરિવારના સભ્યો ત્યાં

દીકરાને વ્યસન ધરાવતા યુવક સાથે ન જવા ચેતવ્યો તો યુવકે આઘેડને ફટકારી

1 (એજન્સી) અમદાવાદ, તા.૨૦ | શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી આંધેડ મહિલાએ તેના દીકરાને વ્યસન ધરાવતા યુવક સાથે ન જવા સમજાવ્યો હતો. જો કે, આ અંગે વ્યસન કરનાર યુવકને જાણ થતા તેણે મહિલા સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ ઠંડા વડે મહિલાને ફટકારી હતી. જેથી તેને સારવાર માટે સિવિલ લઈ જવી પડી હતી. આ મામલે મહિલાએ યુવક સામે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં ૫૦ વર્ષીય શેષકુમારી જયકરણસિંહ ઠાકુર પોતાના પરિવાર સાથે રહે છે. ૧૯મીના રોજ શેષકુમારી પોતાના ઘરે આંગણામાં હતા. ત્યારે ત્યાં જ રહેતો મલખાનસિંહ રાજબહાદુરસિંહ ચૌહાણ ત્યાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને ગોમતી નગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

1 અમદાવાદ, તા.૨૦ | પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને ગોમતી નગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રિપ્સ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે : ટ્રેન નંબર ૦૬૪૦૫/૦૬૪૦૬ સાબરમતી-ગોમતી નગર-સાબરમતી સ્પેશિયલ (બે ટ્રિપ્સ) ટ્રેન નંબર ૦૬૪૦૫ સાબરમતી-ગોમતીનગર સ્પેશિયલ ૨૨ માર્ચ ૨૦૨૪ શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે ૨૨.૦૦ કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે ૨૨:૩૦ કલાકે ગોમતીનગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર ૦૬૪૦૬ ગોમતીનગર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન ૨૪ માર્ચ ૨૦૨૪ રવિવારના રોજ ગોમતીનગરથી સવારે ૦૬.૦૦ કલાકે



જો આપણને એવું પદ આપતા હોય તો સ્થાનિક લોકોના કામો સરળતાથી પાર પાડી શકાય. લોક કલ્યાણ અને ગરીબ કલ્યાણના કામોમાં મુખ યોગદાન આપી શકીએ.' ગઈકાલે (૧૯ માર્ચ) તેમના ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ લાગુ ચૂક્યો હતો. ભાવનગરના એક કાર્યકર્મમાં તેમણે કહ્યું હતું કે, હાલ કોઈપણ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. ભાજપમાં જોડાવા માટે મારું મન માન્યું નથી. મારી ખેડૂતોના પ્રશ્નો માટેની લડાઈ ચાલુ રહેશે. પરંતુ હવે અચાનક તેમના સૂર બદલાયા છે. કનુ કલસરિયાનું કહેવું છે કે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવે તો ભાજપમાં જોડાઈશ. ૬ માર્ચના રોજ સી.આર. પાટીલે મહુવામાં કનુ કલસરિયા સાથે સદ્ભાવના હોસ્પિટલમાં બંધબારણે મુલાકાત કરી હતી.

MAMTA SOLUTION House Keeping નો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે, House Keeping સંભાળ કરીએ છીએ. લેબર કોન્ટ્રાક્ટ કરીએ છીએ લેબર ખેતા હોય તો કોલ કરો કોઈ પણ કંપનીને લેબરની જરૂરીયાત હોય તો કોલ કરો. લેબર (લેડીઝ/જેન્ટલ) છોકરાઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. લેબરને તમામ પ્રકારની ફેસીલીટી આપવામાં આવે છે, જેવી કે મેડીકલ/ખાવા-પીવાનું/રહેવાનું આપવામાં આવે છે. 88 66 21 7393

જાનકી ટ્રેડર્સ FinOlex PIPES NILKANTH STEEL JK SUPER CEMENT. નેહલ મહેતા M :- 97261 06200 nehalmeheta81.nm@gmail.com સીમેન્ટ, ટીએમટી લોખંડ, ઓગલ, પાઈપ્સ, પતરા વગેરે દરેક જાતનું બીલ્ડીંગ મટીરીયલ અમારા ત્યાં વ્યાજબી ભાવે મળશે... અવશ્ય મુલાકાત લો... ગજા સિનેમા પાસે, પ્રતાપપુરા, ઉમરેલી રોડ, સંતરામપુર, જિલ્લા-મહિસાગર

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક સમાચાર પત્ર ઉપાડો ફોન 9800708900 આ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વિડીયો મોકલી આપો દરેક જાતના પ્રસંગ, ઉમંગ, શાળાઓ, કોલેજોથી લઈને સોસાયટીઓ સુધી અવસરથી લઈને તહેવારો સુધી બધા જ સમાચારોને આવરી લેતુ અખબાર "ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત" દૈનિક હંમેશા તૈયાર રહે છે, આપની આસપાસ બનતી રસપ્રદ ઘટનાઓની માહિતી વોટ્સએપ નંબર ઉપર અથવા ઈ-મેઈલ પર અમને લખીને મોકલો... cnngujarat@gmail.com